


१३८२-७

1385



## विषय-दर्शन

विषयः	लेखकः	पृष्ठः
१. भगवान् महावीरः		१२१
२. जैन दर्शनिक साहित्य अने प्रमाणुविनिश्चयः	पू. सु. जंभूविजयज्ञः	१२४
३. लिरसौभाग्यनु रेखादर्शनः	प्रा. श्री. लिरालाल र. कापडिया:	१३२
४. वैलारगिरि अने श्रेणिक महाराजाः	श्रीयुत मेहनदाल दी. चोकसीः	१३७
५. पर्यास-डुसुमांजलि महाकाव्यः	पू. प. श्री. हुरंधरविजयज्ञः	१४०
६. संपादकीयः		१४३
७. आचीन संतवाणीः		टाईटल पेज त्रीजुः
८. साभार-स्वीकार		टाईटल पेज बीजुः



ACHARYA SRI KAILASSAGARSURI GYANMANDIR  
 SHREE MAHAVIR JAIN ARADHANA KENDRA  
 Koba, Gandhinagar - 382 007.  
 Ph. : (079) 23276252, 23276204-05  
 Fax: (079) 23276248

## साभार-स्वीकार

- २५) पू. आ. म. श्रीविजयलभ्यसूरीश्वरज्ञ म. ना उपदेशथी—श्रीधर जैन संघ, ईउर.
- २६) पू. सु. श्रीगौतमसागरज्ञ म. ना उपदेशथी—जैन बाल मंडण, कल्याण.
- ३१) पू. आ. म. श्रीविजयलालयसूरीश्वरज्ञ म. ना उपदेशथी—श्री सीसोहरा जैन संघ,  
सीसोहरा.

- १. श्रीसीभूदर शोभातरंग संपाठ मुनिराज श्रीबलभसागरज्ञ, प्रकाठ श्री जैन  
श्वेतांबर संघनी पेटी, पीपली बजार,
- ईदौर सीढी भूद्य-मे इपिया

नांदः—श्री. उभाकांत शाहे आपेला ‘कङ्काली लिंगे वधु खुलासे’ स्थानाभावे आ  
अंकमां प्रगट थई थाक्यो नथी।

—संपाठ



॥ ॐ અર્હમ् ॥

ભારતલ મારલવર્ષીનું જૈન ક્ષેત્રાસ્પર મૂર્તિપૂજક  
મુનિસમેલન સંસ્થાપિત

શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિનું માસિક મુખ્યપત્ર  
જેણિગભાઈની બાડી : ધીકાંદા રોડ : અમદાવાદ (ગુજરાત)

વર્ષ : ૧૭

મિક્રો નં. ૨૦૦૮ : વીરનિ. નં. ૨૪૭૮ : ઈ. સ. ૧૬૫૨

ક્રમાંક

અંક : ૭

યૈત્ર વદ પ : માનગવાર : ૧૫ એપ્રિલ

૧૯૮



## મહાવાન મહાવીર

૭

[ જગતનાં રાષ્ટ્રો આને શાસ્ત્રીકરણની વોરદોદાર્યાં હરિદ્રાઇ કરતાં હોથ લોમ હિત-પ્રતિહિતના સમાચારોથી જાણાય છે. પરંતુ આ હરિદ્રાઇના અંત કચારે અને કેવી રીત થશે એ કોઈ જાણું નથી. હા, પ્રશિક્ષ અંગે લોખક અંચ. ઇ. વેલસે એવી ભવિષ્યવાળી કરી છે— ‘આવનારી કેટલીક દ્રશ્યમાં માનવજલિ સ્વયં નિર્ભર્ત શર્ણોથી જ પોતાનો સંપૂર્ણ સંહાર કરી નાખશે’ ત્યારે નોંધલ પુરસ્કાર વિનેતા પ્રશિક્ષ દાર્યાનિક લોખક બર્ટન્ટ રસેક આ સંહારમાંથી માનવજલને ઉગારી લેવા કરું છે—‘ને વિશ્વને અને તેની સાથે વૈજ્ઞાનિક સમાજને જીવિત રહેલું હોથ તેં મરુષ્યે ચુદ્ધવિષ્ણાને સહી ભાગે સમાપ્ત કરી દેના નેર્દીશે.’]

આ માર્ગદર્શન વાંચતાં અઠી હળવ વર્ષ પહેલાં થઈ ગમેલા એક મહાયુલ્ઘનું જીવન અને તેમની સાધનામાંથી પ્રગટ થયેલું ઉદ્ઘોષન યાદ આવે છે. નાણે એ પુરાણ વાળીનું આ નતું ઇયાનાર ન હોથ ! ત્યારે એ મૂળ વાળી અને તેનું ઉદ્ઘોષન કરનાર મહાયુલ્ઘના જીવનની મહત્તમાનું સ્વરૂપ આપણી આગળ વિસાઈ રૂપે પ્રગટ થાય છે.

શૈવી શુક્લા ૧૩ નો હિવસ એ મહાયુલ્ઘના જન્મ કલ્યાણુકનો પવિત્ર પર્વહિવસ છે. એ હિવસે એમનું જીવન અને જોખ સૌ કોઈને પ્રેરણા રૂપ થાયો એવી આશા સાચે ‘ધર્મયુગ’ સાપ્તાહિકના તો. ૧૩-૪-પરના અંકુરોએ મહાયુલ્ઘ ભગવાન મહાવારના લોકસ્પર્શી જીવનનો ધ્યાલ આપતો લેખ પ્રણગ થયા છે, તેનો શુલકાતી અતુલાંહ ‘ધર્મયુગ’ ના સૌનન્યથી અહીં આપવામાં આવે છે. —૨૦૮૦]

१२२ ]

શ્રી. જૈન સત્ય પ્રકાશ

[ વર્ષ : ૧૭

**વિશ્વમાં સમગે સમગે માનવતાના કલ્યાણ માટે મહાન દિલ્લીતાઓ જન્મ લેતી રહે છે.** લગવાન મહાવીર પણ એવી જ એક અલોકિક વિર્ભૂત હતા. એનો તપઃપ્રધાન સંસ્કૃતિના ઉજાજથિલ પ્રચીક અનીનો આ પૃથ્વી પર અવતર્ય હતું કાર્યોસર્ગ અને શરીરના સુખદૂષિતની અર્ણદ્વારા રાખ્યા બાગર તેમણે પોતાના જીવનની પ્રેરણશાળા દ્વારા જે અત્યંત આદર્શધૂર્મુખ અને પ્રત્યક્ષ ઉદ્ઘાટરણ પ્રરતું કર્યું તે વિશ્વ ઈતિહાસમાં અદ્વિતીય રહેશે. તેમનું જીવન સત્યાલ્પક પરિધિના ઉત્ત્રમાં એક પ્રકાશપુરુષ સમાન દ્વીપ્યમાન ઇંપે યુગ યુગ સુધી વર્તમાન રહેશે.

જે કે અગવાન મહાવીરના જીવન અને જીવનથી સંબંધિત ઘટનાઓ કલ્યાણ અને શૂખ્લાલ્યક ઇંર્માં પ્રાપ્ત થતી નથી; તેમ છતાં જૈન અનુકૃતિ અને ધાર્મિક સાહિત્યથી બોલી જે સામન્યો ઉપલબ્ધ છે તેના આધારે એ નિઃસંશ્યદ્વે કંઈ શકાય કે લગવાન મહાવીર યુગ-પ્રવર્તક મહાપુરુષ હતા, જેમણે સર્વજ્ઞ અને સમર્થાઈ અનીની દિશને સત્ય અને આદિસાની કલ્યાણપ્રદ માર્ગ અતાવ્યો હતો.

### લગવાનતું શુલાગમન :

યુદ્ધદેવના જન્મથી કંઈક વર્ષો પહેલાં (આજથી લગવાન અઠી હજાર વર્ષ પહેલાં) ભગ્ય દેસમાં જ્ઞાતુંનિય કુલની એક શાખામાં જૈનોના અંતિમ તીર્થીકર શ્રી. મહાવીરનો જન્મ ચૈત્ર શુક્�ા ષ્ઠ ના દ્વિષે થયો હતો. તેમના પિતા ચિદ્ધાર્થ કૃત્રિમદુડાના નામક આસના રાજુ હતા. તથા તેમની માતાતું નામ વિશ્વલા હતું. અગવાન મહાવીરના નિર્વાણ-કાળથી જૈન-ધર્મના અનુયાયીઓમાં વીર સંવંધી ગણુના થાય છે. વીર સંવંત વિક્રમ સંવંતથી ૪૭૦ વર્ષ પુરાણો માનવામાં આવે છે. એવી માન્યતા છે કે, નિર્વાણના સમગે લગવાન મહાવીરની ઉંમર ૭૨ વર્ષની હતી. આથી એમનો જન્મ વિક્રમ સંવંતથી ૫૪૨ વર્ષ પહેલાં માની શકાય એમ છે.

### આદર્શ જીવન :

લગવાન મહાવીરનું જન્મ નામ જર્દીમાન હતું. આલ્યકાળથી જ એમની રૂચિ વૈરાગ્ય અને તપ તરફ હતી. તણેણા શુલ સંકલ્પ અને સંમદ્દું અઙ્ગાને લઈ ને જીવનપથ પર અગ્રેસર થયા હતા. તેમનું હુન નણું ભાગેમાં વહેંચાયેલું મળે છે-તેમના જીવનની પદ્ધતી લાગ આપ્યાને તેમના ગૃહસ્થજીવનનું હર્ષની કરવે છે. ભીજે ભાગ જાની-ધ્યાની અને સાધના કર્મનું ઇધે વ્યક્ત કરે છે. અંતિમ ભાગમાં તેણો વિદોક્ષા પૂજાય સર્વજ્ઞ સર્વદીશી તીર્થી કર અનીને ચંદ્રે છે. એ જ્ઞાતુંનાંહનથી ત્રિલોકવંહનીય મહાપુરુષ બને છે.

જર્દીમાન જ્યારે ૩૦ વર્ષના થથા ત્યારી જ એ સંન્યાસ જીવનના માટે તેમનું ચિત્ર બ્યાંકુલ અનેલું હતું, તેનો સ્વીકાર કરવાના તેમણે નિશ્ચય કર્યે. કેશલુંચન કરીને રાજ્ય છાડી હું ડેવળ એક વખ્તસેર તેણો તપ કરતા નીકળી પડ્યા.

### તપશ્ચર્યાતું ૩૪ :

ગૃહજ્યાગ કર્યો પછી મહાવીરનું ૧૨ વર્ષતું જીવન એ વાતાતું ઉત્તમ ઉદ્ઘાટરણ છે, તપશ્ચર્યાતું સ્વર્ણ કેટલું ઉત્તમા ઉત્ત્ર થઈ શકે; સત્યની શાધને માટે સુસુસુની બ્યાંકુલતા કેટલી

આંક ૭ ]

ભગવાન મહાવર્ણ

[ ૧૨૩

તીવ્ય લોખી જોઈએ; સંશ, આંદુસા, કૃમા, હચા, રોત અને બોગતી ઉચ્ચતા; અપસિથદ, શતિ, હ્યા પ્રત્યાહિ હૈયો ગુણોનો ડિકર્ષ કથાં સુવી સાંખ્ય શક્તય છે તથા ચિત્તની શુદ્ધિ કથી રાતે થઈ રહે છે ?

ગોતાના સાધના કાળમાં ભગવાન મહાવીરે આવરણ સંખ્યી ડેટલાક નાયમો બનાયા હતો— જેઓ, બીજાની સદાયતાની અપેક્ષા ન રાખી, જે ઉપસર્ગ જે પરિણામ ઉપરિથત થાય તેનાથી બચાવાની બેદ્ધાન કરવો, દુઃખ માત્ર પાપકર્મનું ફણ છે અને તે જ્યારે આવી પડે ત્યારે તેના દૂર કરવાનો પ્રયત્ન-આને થતાર દુઃખો અનીયિતી તરફ ડેવા કરવો માનવો.

### કેવળજ્ઞા રની પ્રાપ્તિ :

બાર વર્ષના કંડોર તપણી અને વંશાભ સુહિ ૧૦ ના હિસે ભગવાન મહાવીરને ‘કેવળજ્ઞા’ના દર્શનમેઘિના પ્રાપ્તિ થઈ. તેમના હૃદય કપાટ ખુલ્લી ગયાં; સંશ બધા મરી ગયા, રૂતનો સ્નોત ગેમટી પડવો અને જન્મથાને માટે કંઈ જ આડી ન રહ્યું.

જે પણી ભગવાને ઉપદેશ દેવાનો પ્રારંભ કર્યો. તેમણે ઉપદેશ ડાઈ બ્યાન્ઝ માટે નાંદ, પરંતુ સેણ કલ્યાણની આવનાથી આત્મોત થતો હતો. તેમણે સર્વ પથમ ઉપદેશ હતો. અંદિંસા, તેમણે કહ્યું કે— “ સૌ ડાઈ લ્યવાને છિંછે છે, અધાને લ્યવન પ્રિય છે, સૌ ડાઈ સુધી અન્વાને છિંછે છે, દુઃખથી દૂર રહેવાને ચાહે છે. આદ્ય ડાઈ પ્રાણીને કષ્ટ આપવું હિક નથી, (આચારણ ) તેમના કહેવાનું તાત્પર્ય એ હતું કે—જે એં જાણાદ સે સર્વ જાણહે જે સર્વ જાણાદ સે એં જાણાદ ॥ (જે એકને જાણે છે તે અધાને જાણે છે, જે અધાને જાણે છે તે એકને જાણે છે.) તેમણે સંચંદ અને તપતે ઉત્કૃષ્ટ ધર્મ બતાવ્યો. કલ્યાણુભવ ઉપદેશ :

ભગવાન મહાવીરનું કથન હતું કે આત્મવિકાસની સર્વોચ્ચ અવસ્થાનું નામ ધર્મિકર છે. જ્યારે મતુષ્ય રાગદેવથી વિમુક્ત અની જય છે—અર્થાતુ મતુષ્ય ધર્મિકર બને છે—તે પછી તેને સંસારની સુધ્દાના પ્રપંચમાં પડવાથી શે લાભ ? તેમણે દ્વૈબદ્ધા કરી હતી કે— હે મહુંયો ! તમે જે ચાહો તે કરી શકો છો, જે છિંછો તે અનો શકો છો, તમારા ભાગ્યના વિધાતા તમે જ છો, પુસ્તપાર્થીપૂર્વક અધ્યબદ્ધાને તણુ હઈ આગળ વધ્યે જાઓ, હષ્ટ સિદ્ધિ અવસ્થ રહો જ.’ મહાવોરનો ‘સ્થાદાહ’ તત્ત્વવિનિતનમાં ખણું જ મોહું અવદાન મળાય છે.

### મહાનિર્વાણ :

આર વર્ષ સુધી કઠળું તપ કર્યી પણી ભગવાન મહાવીરે ત્રીશ વર્ષ ઉપદેશક અવસ્થામાં વ્યતીત કર્યો. તેમણે દૂર દૂર સુધી પરિબ્રમણ કર્યું અને લોકાને અંદિંસા અને કલ્યાણને ઉપદેશ દઈ ને લોકહિતનું પ્રદર્શન કર્યું. લારથી કાર્તિક અમાવાસ્યાના પ્રાતઃકાળમાં તેમણે પોતાનો અંતિમ સમય જાણીન પુષ્ય-પાપ વિવયક અનંક ઉપદેશ સંભળાવ્યા અને નિર્વાણને પ્રાપ્ત કર્યું. સંસારની એક હિન્દુ વિલુતિ ચાલી ગઈ. સંસાર શોકાવહિન બની ગમ્યો.

# जैन दार्शनिक साहित्य अन प्रमाणविनिश्चय

लेखक : पूर्ण भुनिराज श्रीजंग्युविजय

**जैन दार्शनिक साहित्यना अस्थासीओं आ छोड़तयि सुपरिचित हे कृ दार्शनिक साहित्यना अथेमां अन्य अथेमांथी पुष्टग अवतरणा। उक्त करेवा होय छे, कारण डे दार्शनिक साहित्यनो उद्देश रव-परमततु भंडन अंडन-करवानो हावाथी तेमां अन्यान्य भतोनो खूब ज मेटा प्रभाषुमां उल्लेख करवामा आवे छे आथी ते ते भत-भतांतरोनां भूमि स्थाने शोधी काढवामां आवे तो भूमि लाभतु दार्शनिक साहित्य धरणा अंश सुगम विशद अने शुद्ध थर्थ ज्ञाय छे, आथी अंतीवा संपादको अने वाचको ते ते भतोनां अने अवतरण वाक्योनां भूमि स्थाने शोधी काढवा माटे अतिराय जहेमत उद्घावे छे, कारण डे भूमि स्थाने शोधी काढवाथी जे नवीन प्रकाश पडे छे जे प्रक्षशना अणथी अंश खुब ज विशद अनी ज्ञाय छे,**

परंतु दूर्देवे कलना भोदात्म्यथी डेटलाङ्क महत्वना प्राचीन अर्वाचीन अंथें नाश पामी गयेला अथवा अनुपलब्ध छेय छे, आवा अथेमांथी उक्त करेवा याचोयोनां भूमि ज्ञायवा भाटे संशोधको अतिराय नपास करवा होय छे, कारण डे भूमि स्थानोना अलावे धरणा भाष्टो उपर अध्यकार अवयेको रहे छे, आम छतां कठाचित् हृवयेगी, ते नाश पामेवा भनाता अथें डोर्छ अप्रगट प्राचीन अंथसंग्रहेमाथी भणी आवे छे त्यावे ते विषयना संशोधकोने जे आनंद थाय छे ते वर्णनातीत होय छे,

दार्शनिक साहित्यना अस्थासीओं सारी रीते ज्ञाने छे कै बौद्धाचार्य धर्मकीर्तिनां संकेतो वक्तो दार्शनिक अथेमां उक्त करेवां छे, आज्ञे ज अवो डोर्छ प्राचीन भारतीय दर्शन साहित्यना अंथ छेते जेमां धर्मकीर्तिनुं अंकाद वाक्य उक्त करेतु नहीं होय, धर्मकीर्तिना नाश पामेला भनाना डेटलाङ्क अथें उभयां ज अगट थया छे, छतां हजु खु अवो डेटलाङ्क वयेनो छे कै जे तेमांको भणतां नहीं, भणी ज्ञायवतो खुब आनंद थाय छे कै दार्शनिक अथेमां डाम शाम उक्त करेवा अन जेनां भूमि स्थानोनो हजु सुधी पतो लागतो नथी तेवा धर्मकीर्तिना डेटलाङ्क सुप्रासङ्ग वाक्योनां भूमि स्थानो धर्मकीर्तिराचत, ‘प्रभाषु-विनिश्चय’ अंथना इमेटन आपांतरभाथी शोधी काढवामां हु सक्ण थयो छुं,

अे ज्ञायवतां पहेलां धर्मकीर्त, तेना अथें तथा तेना इमेटन आपांतरेनो थापो परिचय आपवो अस्थाने नहीं ज्ञाय.

बौद्धाचार्य धर्मकीर्तिनुं बौद्ध हर्यनपर परमां धरणा ज महत्वनुं स्थान छे, हिन्दूनाग बौद्धदर्शननो पिता ( Father of the Buddhist Logic ) कहे गय छे, आ हिन्दूनागना सिद्धांतोने पत्तवित करवानुं अने वेग आपानातुं कर्म जे डोर्छ ए क्युं होय तो धर्म-कीर्तिए क्युं छे, अम कडी शकाथ के हिन्दूने भीज रोप्युं अने धर्मकीर्तिए तेमांथी वरवृक्ष अनाव्युं, चीनी याची ईतिहास भारतवर्षमां पर्यटन क्यों पछी तेनां संस्मरणेती नोध इपे एक अंथ चीनी आपामां लगलग ईर्वीसन ६८१ मीं लघ्यो छे, तेमां तेमाने धर्मकीर्तिनुं खूब वर्णन क्युं छे अने ज्ञायव्युं छे कै ‘हिन्दून धर्मकीर्तिए हेतु-

अंक : ७ ] लैन हार्षनिक साहित्य अने प्रमाणविनिश्चय [ १२८

विद्याने वधारे विकसित करी छे—शुद्ध करी छे' धृतिसंगे धर्मकीर्तिना डेटलाक शिखेन्तु' पण वर्षानुन झर्नु' छे. तेथी सन ६५० थी ६८५ सुधी धर्मकीर्तिनो उद्द्य काल मानवो ढीक लागे छे.

### धर्मकीर्तिना न्याय अथे।

आ धर्मकीर्तिये सात न्याय अथेनी रचना करेली छे—

१. प्रमाणवार्तिक, २. प्रमाणविनिश्चय, ३. न्यायविन्दु, ४. हेतुबिन्दु, ५. सम्बन्ध-परीक्षा, ६. सन्तानान्तरसिद्धि, ७. वादन्याय.

आ सात अथेमां अत्यार सुधी 'न्यायभिन्दु' ज संस्कृतमां भणतो हो. अने ते पछु भारतवर्षमां भाव लैन अथलं डारेमाथी ज मणी आवो हो. आडीना वधा अथेसां संस्कृतमां नष्ट थर्द गयेला ज मानवामां आवता होता. परंतु हमणां थेडां वर्षी पूर्वे औद्ध प० राहुल संकृत्यायने टिमेटना जूना संयुक्तस्थानोमां धूग आता 'प्रमाणवार्तिक' तथा 'वादन्याय' आ ऐ अथे. अने तेनी डेटलीक ढीकओ शोधी काढ्या पडी तेनु संस्कृतमां अस्तित्व प्रगट थयु' छे. आडीना अथेनु' हजु टिमेटन भाषांतर ज मले छे. आ अथेनो संक्षिप्त परिचय नीये प्रमाणे छे :

**१. प्रमाणवार्तिक**—आ अंथ धर्मकीर्तिना सात अथेमां सौथी वधारे महत्वनो गण्याय छे. आप्या अंथ डारिकातमक छे. आना ४ परिच्छेद छे—१. स्वार्थनुभान, २. प्रमाण, ३. प्रत्यक्ष, ४. परार्थनुभान. आमां १ला परिच्छेद उपर धर्मकीर्तिनी स्वेष्टवृत्ति, तेना उपरनी कर्णुकगेमिनी ढीका साथे किताबमहल, ( अलाहाभाद )थी होइ वर्षी पूर्वे प्रकाशित थर्द छे. आडीना तेणु परिच्छेदो उपर प्रज्ञाकरण्युपते रचेली 'वातिंकालांकर' नामनी ढीकनो थेडा. अंश पट्टणानी 'धी बिहार एन्ड ओरिसा रिसर्च सोसायटी' ना जर्नलमां तेमज भाषाभिधि सोसायटी ( सारनाथ ) तरफी थर्द थये. आडीनो वधे लाग अमारी खासे हस्तलिखित छे. आ यारे परिच्छेदो भूग्र भाव, तेमज 'भोवरथननिहनी' ढीका साथे अिहार एन्ड ओरिसा रिसर्च सोसायटीना जर्नलमां होइ वर्षी पूर्वे प्रगट थया छे. आ सिवाय हेवेन्द्रभति नामना धर्मकीर्तिना शिष्य तेमज भीज थण्याओऱ्ये आना उपर वृत्तिओ रचेली छे. परंतु ते संस्कृतमां अत्यारे भणती नथी, तेनु टिमेटन भाषांतर ज भाव मले छे.

**२. प्रमाणविनिश्चय**—आ अंथ प्रमाणवार्तिक जेवो ज संस्कृतमां अने भोयो छे. संस्कृतमां आ अंथ भणतो नथी. भाव टिमेटन भाषांतर भणे छे. आ अंथ उपर धर्मोत्तरी धण्णी भेडी ढीक<sup>१</sup> मले छे के के 'वृहुद्धर्मोत्तर' ना नामथी ओणभाय छे. आना उपर ज्ञानश्रीभद्रनी पणु नानी वृत्ति भणे छे.

**३. न्यायविन्दु**—आ अंथ अने तेना उपरनी धर्मोत्तरनी वृत्ति के के 'लधुवर्मोत्तर' ना नामथी ओणभाय छे ते लैन अथलं डारेमां संस्कृतमां भणतां होवाथी धणु ज वर्जतथी

१. एडींग एवीशनमां तंजूर, मदो, जे CIX = १०८ नंवरनी गोथीना ३४७ पाना तेमज तंजूर मदो, वे CX = ११० नंवरनी गोथीना २०८ B खाना सुधी आ अंथ छे. तेमज १२४६३ श्वेकप्रमाण छे. आ पडी २०८ B थी ३५५ पाना सुधी ज्ञानश्रीभद्रनी वृत्ति छे.

[ १२६ ]

श्री. लैन सत्य प्रकाश

[ वर्ष : १७

प्रसिद्धिमां आवेला छे. आ धर्मोत्तरनी वृत्ति उपर भव्यवाही के ने 'नयचक्र' कार शीभव्यवाही क्षमात्रमण्डसुरि (विक्रमना पाठ्यमा सैकाना) थी निश्चये विन छे, तेमणे रचेलु' एक इत्प्रथा तथा एक धीर्जु इत्प्रथा पछु जेसलमेर तथा पाठ्यना लैन अंथबंडारोमां भगे छे, जे हजु छपायेल नथी. आ सिवाय विनीतहेवे रचेली एक वृत्ति पछु छे पछु ते संस्कृतमां नथी भगती, टिएटन भाषांतर भगे छे.

**४. हेतुविन्दु<sup>१</sup>**—आनी अर्च्यद्वृत शीका पाठ्यना लैन अंथबंडारमां ज भगे छे. आ शीका वडोहरानी गायकवाड ओरिएन्टल सीरीजमां छाईर्थ गम्फ छे. तेनी साथे हेतुविन्दु मध्य पछु छापवामां आव्यु' छे के ने 'उत्पादादिसिद्धि' नामना लैन अंथमां आवतां हेतुविन्दुना भूम्प लांबा अवतरणेनो संचाह करीने तेम ज भूटता आग्नं टिएटन लाखान्तर उपरथी संस्कृतमां भाषांतर (Retranslation) करीने तैयार करवामां आव्यु' छे. 'हेतुविन्दु' टिएटन लाखांतर स्लू-घड ओडीशनमां तंजूर मदो XCV (=१५) पृ. ३५३-३७६ मां छे.

**५. संबंधपरीक्षा<sup>२</sup>**—आ अंथ मात्र २५ कारिकानो छे. आ संस्कृतमां नाश भाषी गयो भनाय छे. टिएटन भाषांतर ज भात्र भगे छे. परंतु 'स्थाकादेश्त्वाक्तर, प्रभेयकमलमार्त्तषुङ्, न्यायकुमुहूर्यांद्र' विगोरे लैन अथेभामां आनी २२ कारिकाए उद्धृत करेली छे एटले लगभग आप्यो आ अंथ ज लैन अथेभामां समाई गयेसो हेत्वाथी तैयार करी शकाय तेम छे. हु तेना टिएटन भाषांतर साथे टूँकु सुहतमां ज आप्यो अंथ प्रगत करवानो छु. छेवटनी त्रय कारिकाए जे केार्थ अंथभार्थी भगा आवे तो संपूर्ण तैयार थैर्थ जशे. अ शोधवातुं आम भाषा छे. 'संबंधपरीक्षा' उपर धर्मज्ञातीर्तनी स्वेपत्तिपूर्व छे. आनुं पछु टिएटन भाषांतर ज भगे छे, टिएटन भाषांतर उपरथी तेम ज जैन साहित्यने आधारे आ आवृत्ति पछु घणे अंश संस्कृतमां तैयार करी शकाय तेम छे.

**६. सन्तानान्तरसिद्धि**—आ भूम्प अंथ मात्र एक ज कारिकानो छे. तेना उपर टिएटन लाखांतरमां (पृ. ४१७-४२१ सन्थहू गोडीशन) धर्मज्ञातीर्तनी स्वेपत्तिपूर्व विस्तारथी छे, भूम्प जे एक कारिका छे ते काश्मीर राज्य तरक्की ग्रसिद्ध थेला नरैवरपरीक्षा। नामना अंथमां उद्धृतकरेली भगा आवे छे के ने नाचे प्रभाषे छे:

बुद्धिपूर्वी कियां दृष्टा स्वदेहेऽन्यत्र तदग्रहात् ।

ज्ञायते यदि धीश्वित्तमात्रेऽयेष नयः समः ॥

**१ आना** उपर विनीतहेवे रचेली वृत्ति टिएटन भाषांतरमां भगे छे. जुओ गेहांग ओडीशन तंजूर मदो, जे CXI (=१११) पृ. १२३ B-२२३ B.

**२ आना** उपर विनीतहेवे तथा शंकरान्दहै रचेली वृत्तिअौ गेहांग ओडीशननी तंजूर, मदो, CXII (जे=११२) नं अंतर्नी ग्रतिभामां भगे छे. पृ. १-२६ तथा २७-४४ A

**३ युद्धकम्**—बुद्धिपूर्वी कियां दृष्टा स्वदेहेऽन्यत्र तदग्रहात् ।

ज्ञायते यदि धीश्वित्तमात्रेऽयेष नयः समः ॥

—नरैवरपरीक्षा पृ. ६२ (काश्मीर सीरीज नं. ४५)

**४ आव्यु** टिएटन भाषांतर नाचे प्रभाषे छे:-

रङ्-लुस् ल्लो-स्तोन्-ड्यो-ब यि व्य-ब-म्योड-नस् गूशन्-ल दे ।

અંક : ૭ ]

બૈન દાર્શનિક સાહિત્ય અને પ્રમાણવિનિશ્ચય

[ ૧૨૭ ]

૭. વાદન્યાય—આ અંથ અને તેના ઉપરની શાન્તરક્ષિત (‘તત્ત્વસંગ્રહકાર’) રચિત ‘વિપર્યિનાર્થ’ નામની ગૃહિ બૌદ્ધ પં. રાહુલ સાંકૃત્યાયને ટિએટમાં ડોઈ મહમાંથી શોધી કાઢયા પણ પિલાર એન્ડ આરિસા રિસર્વ સેસાયટી (પટથા)ના જર્નલમાં (૨૨મા વેલ્યુમમાં) તેમજ મહાભોગી સોઝાયરી (સારનાથ) તરફથી સોળ વર્ષ પૂર્વે પ્રગટ કરેલાં છે. આના ઉપર વિનોતદેનની પણ પ્રચીન રીત ટિએટનાંલાખાંતરમાં Tangur Mdo CX11 (=112) P. 44a 71a (Peking edition)માં મળે છે.

ઇજિન ફિલ્ટર ગલ્ડ-તે બ્લો શેર, ઇગ્યુર સેમસુ-ચમ્-લ યદ્ છુદ ઇદિ મલ્લ્યસ ॥

—તંજુર, સ્ટો. XCV (=૧૫) પૃ. ૪૧૮ A (સન્-થદ)

૫. આ જણાવવા અફલ શ્રી. પુરુષોત્તમદાસભાઈ તારકસ (આડોલાવાળા)ને અભિનંદન આપું છું.

#### ૬. ટિએટન ભાષાંતરોના પરિચય—

સંસ્કૃત અંથોના ટિએટન ભાષાંતરો આજથી લગભગ હજાર વર્ષ પૂર્વે થયેલાં છે. ભારતમાંથી ગૃહેવા પદિત અને ટિએટના પાંડિત એમ જે ભેગા મળાને સંસ્કૃત અંથોનો અતુનાદ કરતા, એવી પદ્ધતિ હતી. તેથી અન્યોન્ય ભાષાદાનમાં જે અપૂર્વીતા હોય તે દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવતો હતો. આ બધા અંથોનું પાછલના એક બૌદ્ધ ભાષાએ બે વિભાગમાં વર્ગીકરણ કર્યું હતું—૧ કંજૂર, ૨ તંજૂર. સૂતોનાં ભાષાંતરો કંજૂરમાં છે. ન્યાય, વ્યાકરણ, કાબ્ય, ડેશ, વિગેર વિવિધ વિષયોનાં ભાષાંતરો તંજૂરમાં છે, બધા અંથોની મેળી મેળી પોથીઓ ભનાવેલી હોય છે. એક એક પોથીમાં અનેક અંથો હોય છે.

કેટલાંક વધો ભધા પણ આ હસ્તલિખિત પ્રતિ ઉપરથી લાકડાં ઉપર કોતરકામ કરીને એક પ્રકારના બ્લોક જેવા લાકડાંના પાટિયાં અનાવવામાં આચાં. આ પાટિયાંને શાહીમાં જોગાને આ અંથો કાગળ ઉપર ભાપવાની શરૂઆત થઈ. આવાં પાટિયાં પાંચ જગ્યાએ બનાવવામાં આચાં હતા—૧ છોની, ૨ પેડીંગ, ૩ હેન્દે, ૪ સન્-થદ, ૫. હેડાસા. આથી તે તે સ્થાને છ્યાયેવા અંથો તે તે એડીશનના નામથી એણાખાય છે. એમકે છોના એડીશન, પેડીંગ એડીશન વિગેર. આમાં છોની-(ચીનના પ્રદેશ)નાં લાકડાના પાટિયાં પાંચસો વધો પૂર્વે લુંટારુણોએ ભાળી નાખ્યાં હોયથી એ એડીશનની હવે નથી નકલો મળતી નથી. અમેરિકાના વેશિચ્છિનમાં Library of Congress (Washington 25, D. C.) માં આની ગમે ત્યાંથી ભળવેલી એક નકલ છે. આ બહુ સ્પષ્ટ છ્યાયેલ છે.

પેડીંગ એડીશનના લાકડાના પાટિયાં પણ ભાગવાયોરેશે સને ૧૬૦૦માં ભાળી નાખ્યાં હોયથી હવે આની નકલ મળી શકતી નથી. પેરાસના (ફ્રાન્સ) La Bibliothèque Nationale નામની લાયખરીમાં એ અંથો છે. જાપાનમાં પણ હોય છે. આ લાલ શાહીથી છાપેલું એડીશન છે અને તેના અસ્થરો સ્પષ્ટ છે.

હેન્દે એડીશન પણ સ્પષ્ટ છે. પરંતુ હેન્દે ચીનની સરહદ પાસે ટિએટમાં બહુ દૂર આવેલું છે. એટલે ત્યાંથી તે એડીશન મેળવવું બહુ સુષ્ણેલ છે.

હેડાસા એડીશન સ્પષ્ટ છે પણ તેમાં ‘તંજૂર’ વિભાગ છે જ નથી.

સન્-થદ એડીશન જ જગતમાં વ્યાપક છે. પણ તેનાં લાકડાના પાટિયાં ધર્માઈ ગયાં

१२८ ]

श्री. जैन सत्य प्रकाश

[ वर्ष : १७

धर्मकीर्तिंना अथेनो आटले। परिचय आप्या पठी केटलांक सुप्रसिद्ध अवतरणानां भूमि स्थग्ना जग्यातुं ते पहेलां अेक वात जग्याई हड्डीं के इष्टेटन लाखांतर करनारा पंडितोंचे केटलीकवार संस्कृतनो। अर्थ बराबर न समजवाथी लाखांतर करती वर्षते भूल करी नाही छे. वणा, जे संस्कृत प्रति उपरथी तेमध्ये लाखांतर करेलुं ते प्रतिमां जे पाडे अशुद्ध होय ते पाडाना लाखांतरे पण अशुद्ध व॒ थेवेकां छे. जे लाकडाना ज्वोडाथी इष्टेटन अथेना भापवामां आवे छे ते ज्वोडा कातरनारने लाग्ये पण व्याहीवार भूल थर्त्तव्य. एटले इष्टेटन अथेनां जुहा जुहा एडीशनोमां पाठ लेहो ज्वेवामां आवे छे. अस्तु.

हुं जे 'प्रभाषुविनिश्चय' भाषी भूमि स्थानो आपवानो झुं. ते स्न॒ थळ एडीशननां छे अने ते तंजूर नामना मद्दो विभागनी चे (६५) नंबरनी प्रतिमां पृ. २५८A थी ३४८A सुधी छे. आ अंथ अने यीज अनेक अथेने भौमि सुर राज्यनी ओरियोन-एल रिसर्च मृण्युट्युना सुप्रिन्टेन्डन्ट श्रीमान् रंगास्तवामी रामानुज आथंगर (H. R. R. Iyengar) के जे मारा विदान् भित्र छे अने इष्टेटन लाखाना विदान छे तेमना सौमन्यथी हमध्या प्राप्त थ्या छे ते व्यक्त तेमने धन्यवाद आपुं झुं.

आ इष्टेटन पानांओनी लंबाई-पहेलाई "२२५८॥" ईय होय छे. अने आजुमो छापेलुं होय छे. पानानी प्रत्येक व्याजुमां सात सात लीटी होय छे. इष्टेटन विपि अवग प्रकारनी होय छे. अडीं तेतुं हैवनागरीमां परिवर्तन करीने आपवानां आवशे. पहेलां इष्टेटन अने पठी तेतुं संस्कृत आपवानां आवशे.

टिबेटन—फन्-प दड् मि-फन्-प थोव्-प दड् स्पोड्-ब-नि डेस् पर् यड्-दग्-पडि शेस्-प-स्डोन्-दु-ओ-ब चन् यिन्-पस् न दे मि-मखस्-प नेम्सु-ल बूत्तन्-पडि-दोन्-दु डि वृचम्-प मे ।

यड्-दग्-पडि शेस्-प दे-नि नेम्-प ग्रजिस् ते । मडोन्-सुम् दड् नि जैस्-सु-दपग् चेस् व्यडो । डदिदग् गिस् दोन् योडस्-सु-दप्पद्-नस् डजुर्-प-नि दोन्-व्य-व ल वस्तुब्-मेद्-पडि-मियर्-रो ।.....छद्-म नेम् ग्रजिस् खो-न स्ते डब्लू-ब-नि ग्रशन्-लम् मडोन्-सुम्-म-यिन्-प । ड-बडि वदग् तु तोगस्-मियर्-रो । —प्रमाणविनि. पृ. २५९ A-B

संस्कृत—हिताहितप्राप्तिपरिहारयोनियमेन सम्यग्ज्ञानपूर्वकवाद् तदपट्टनां व्युत्पादनार्थ-मिदमारम्यते ।

[ प्रत्यक्षमनुमानं च प्रमाणे सद्शात्मनः ।

अप्रत्यक्षस्य सम्बन्धादन्यतः प्रतिपत्तिः ॥ ]

तत् सम्यग्ज्ञानं द्विविधम्—प्रत्यक्षमनुमानं चेति । न ह्याभ्यामर्थं परिच्छिव प्रवर्तमानोऽर्थक्रियायां विसंवादते ।.....। प्रमाणे दे एव, सद्शात्मनः अप्रत्यक्षस्य सम्बन्धादन्यतः प्रतिपत्तिः ।

होवाथी या अन्य डोर्डी कारणे सांगु छापकाम थतुं नथी. तेथी अनेक ज्यायाचे अक्षरे तूटी जाय छे, धारा पडी जाय छे, अने वराबर वांची शक्ततुं नथी.

અંક : ૭ ]

નેન દાર્શનિક સાહિત્ય અને પ્રમાણવિનિશ્ચય

[ ૧૨૬

ટિવેટન—ગુણન દગ્ધ મડોન-સુમ-મ-યિન-પદિ છુદ-મ નિ મેદ-દો શેસુ ઝેર-વ દે નિ રિગ્સ-પ-મ-યિન-તે । ગડ્ધ-ગિ-મિયરછુદ-દળ્દ-ચિગ્-શોસુ સિથ-ગુણગ દલ્દ । ગુણન-લો તોગ્સ-પુન-વ્યેદ-મિયર દલ્દગડ-દિગ્રુ-ડગ્રોગ-પર-વ્યેદ-મિયર । છુદ-મ-ગુણન નિ સિદ્ધ-પ-યિદ ।

સંસ્કૃત—અન્યે ‘અપ્રાત્યક્ષ પ્રમાણ નાસ્તિ’ ઇત્યાહુ; તત્ત્વ યુજ્યાતે, યસ્માત्

પ્રમાણેતરસામાન્યસ્થિતેરન્યધિયોગતે: ।

પ્રમાણાન્તરસદ્વાવઃ પ્રતિવૈધાત્ત્ર કસ્યચિત् ॥

આ કારિકા ઉપર [ “દે શેસુ-વહિ ગુસલ્-વ ડગડ-દિગ્રુ=સ હિ કાશ્ચિજ્ઞાનવ્યક્તિ:” ]  
વિગેરે શાખ્દોમાં ધર્મકૃતિંતું વિસ્તૃત વિવેચન છે.

ટિવેટન—ડિલિતર—

મડોન-સુમ યડ્ધ નિ દોન-મેદ-ન । મિ-દ્વયુદ્ધ-વ-લસુ છુદ-મ-યિદ । ડ્રેલ્-વ-યિ નિ રહ્દ-  
બ્યાન્ દેડિ । ગર્દુ-યિન-પસુ-ન ગ્રાનિસુ-ક મલ્લુદ્દુસુ । —પ્રમાણવિનિ૦ પૃ. ૨૧૧ A

સંસ્કૃત—તથા હિ—

અર્થસ્યાસમ્ભવેડભાવાત् પ્રત્યક્ષેડપિ પ્રમાણતા ।

પ્રતિબદ્ધસ્વભાવસ્ય તદ્વેતુલે સમું દ્વયમ् ॥

ટિવેટન—ગુણન યડ્ધ—

દોન નિ જે-વ્ર-સ્વયોર-વ-નડડ । ગુણન યડ્ધ સ્પ-સ્વયોર દ્રન-પ લ ગલ્-તે દ્વબ્ડુ-પોડિ-લ્લો  
લ્લોમ્ । દોન-દે છોદ-પર ડાયુર-વ યિન । —પ્રમાણવિનિ. પૃ. પૃ. ૨૬૧ A

સંસ્કૃત—અન્યાત્—

અર્થોપદેશેડપિ પુન: સ્માર્ત શબ્દાનુયોજનમ् ।

અક્ષધીર્યદ્વાપેક્ષેત સોડર્થો બ્યવહિતો ભવેત् ॥

ટિવેટન—ડેડિ-મિયર—

ગડ્ધ સ્ડોન લ્લો-યિ સ્ક્યેદ-વ્યેદ મિન । બેર-સ્વયોર લ્યદ-પર મેદ-પદિ-મિયર । દે નિ  
મિયર ક્વડ્ધ ડાયુર દેન ન । દોન-મેદ-ન યડ્ધ મિયર-લ્લોર ડાયુર । —પ્રમાણાવનિ પૃ. ૨૬૩ A

સંસ્કૃત—તસ્માત्—

ય: પ્રાગજનકો બુદ્ધેરૂપયોગાવિશોषત: ।

સ પશ્ચાદપિ તેન સ્યાદર્થપાયેડપિ નેત્રધી: ॥

१३० ]

श्री जैन सत्य प्रकाश

[ वर्ष : १७

टिबेटन—दबड़-पोडि व्य-ब-मेद-प-ल। स्त्र-यिस् दोन् नि मथोड़-ब बृशिन् ल्लो-ल  
स्तड़-ब मेद-पडि-पियर्। दे नि बूजोंद-मेद् तोंगसु-व्येद् यिन् —प्रमाणविनि. पृ. २६५ A

संस्कृत—शब्देनाव्यापृताक्षस्य बुद्धावप्रतिभासनात् ।

अर्थस्य दृष्टाविव तदनिर्देशस्य वेदकम् ॥

टिबेटन—डोन्-दे नि मडोन्-सुस् म-डेस्-पडि-बदग्-जिद्-लस् जि-ल्तर् थ-स्त्रद-दु  
झयुर्। डिदो शेम् व्य-बर् लेस्-न नि बूदे दब् सुग् बृस्तल्-यिय स्त्रुव्-पर्-व्येद्-प-दग्  
थोब्-प दब् र्पोड़-बाढ दोन् दु ड्जुग्-पडि फियर्-रो शो-न। स्त्रोन् डिदि मेद्-दो। गड़-गि-  
पियर्—

<sup>१</sup> दोन् मथोड़-ब डिदि मथोड़-र्नस्-ल। स्त्रोड़-बडि मथु-लस् व्युड़-ब यि। इन्-लस् मडोन्  
पर् डदोद्-प-यिस्। थ-स्त्रद रब्-तु-ड्जुग्-प यिन् ते। —प्रमाणविनि. पृ. २६५ B

संस्कृत—ननु प्रत्यक्षस्य अनिश्चयात्मकत्वात् कथं व्यवहारः, ‘इदम्’ इति निश्चये हि  
सुख-दुःखसाधन-प्राप्तिपरिहारार्थं प्रवृत्तेरिति चेत्, नायं दोषः, यतः—

तैदृष्टावेव दृष्टेषु संविसामर्थ्यभाविनः ।  
स्मरणादभिलाषेण व्यवहारः प्रवर्तते ॥

टिबेटन—गूशान्—

यड् लहन्-चिग् दमिग्स्-प डेस्-पडिपियर्। र्स्डो-दड् दे-ल्लो गूशान्-म यिन् ।

—प्रमाणविनि. पृ. २७४ A

संस्कृत—अन्यच्च—सैंहोपलम्भनियमादमेदो नीलतद्वियोः ।

टिबेटन—दमिग्स्-प मडोन्-सुम्-म-यिन्-नै । दे मथोड़ रब्-तु-ड्जुव्-पर्-झयुर् ।

—प्रमाणविनि. पृ. २७४ B

१. अडी 'दोन् मथोड़-ब डिदि' पाठ ऐटो छे. आना उपरनी धर्मकार्तिनी दीक्षामां 'दे-मथोड़-ब-जिद्-न' पाठ छे ते ज साचो छे,

२. आ कारिका नांदिसूत-भवयगिरिष्टिं आहि अनेक अंत्रोमां उद्धत करेली छे.

३. विवरणुप्रभेयसंग्रहमां आनी साचे “अन्यचेत् संविदो नीलं न तद् भासेन संविदो” विगेर होइ कारिका उद्धत छे, पण ते अभाषुविनिश्चयमां नथी.

४. अडी 'दे मथोड़ रब्-तु-ड्जुव्-पर् झयुर्' पाठ ऐटो छे. दीक्षा तथा औज्ञ प्रभाषेने आधारे विचार करतां 'दोन् मथोड़ रब्-मि-ड्जुव्-पर् झयुर्' पाठ साचो जथाय छे,

अंक : ७ ]

लैन हर्षनिक साहित्य अने प्रभाषुविनिश्चय

[ १३१

संस्कृत—अप्रत्यक्षोपलम्भस्य नार्थदृष्टिः प्रसिद्धति ।

टिवेटन—गलु-ते गुजिस्-कडि छूँ-मडि युलु-दडोस्-पो यिन् न दे नि जि-ल्त् र् र्तग्स्-लस् स्थि तोंगस् ल । गशन्-लस् नि रड्-गि-मछन्-चिद् यिन् शे-न । बशद्-प—

‘दे-बृशिन्’ (दे-मिन्) रड्-बृशिन् ल [स्]ल्दोग्-पडि । दडोस्-पो चम्-शिण् रव्-स्प्रव्-मियर् स्थिडि युलु-चन्-दु बृशद् दे । ल्यद्-पर् गनस्-प मेद्-मियर्-रो ।—प्रमाणविनि० पृ० २७७ A.

संस्कृत—यदि द्विविधः प्रमाणस्य विषयः कथं लिङ्गात् सामान्यं प्रतीयते, अन्यस्मात् स्वलक्षणमिति चेत् । उच्यते—

अतद्वूपरा वृत्तवस्तुमात्रप्रसाधनात् ।

सामान्यविषयं प्रोक्तं लिङ्गं भेदाप्रतिष्ठितेः ॥

आमां ने श्वेतोऽपि तेना उपर धर्मशीर्तिनु स्वेषता विवेचन पशु प्रभाषुविनिश्चयमां ज छे परंतु ते अधुं आ संक्षिप्त लेखमां आपतुं शक्य नथी. प्रभाषुविनिश्चय गद्य-पद्धात्मक छे. अर्थात् ते क्षारिकाएँ अने तेना उपर धर्मशीर्तिना स्वेषता विवेचनथी अनेको अंथ छे. उपर ज्ञानां छे ते सिवाय भीजां पशु अनेक अवतरणानां मूल स्थानो. आ अंथमां तपास कर्त्तव्यामां आवे तो भणी शेष तेम छे. ते भाटे अवतरण वाक्योनो संग्रह कुरीते आ अंथनुं व्यापक परिशीलन कर्वुं लेईए. लैनसाहित्यमां आवां पुष्टण अवतरण वाक्यो भरेकां छे. लैनसाहित्य ए भरेभर भारतीय संस्कृतिनां आचीन विज्ञान, कला, पुरातत्त्व विगेर अनेक दृष्टिए अभूत्य अनन्तो छे. भीजे स्थाने हुर्वांज अनी अनेक महाभूत्यवान सामयी अने माहिती संशोधकोने लैनसाहित्यइपी महासागरमाथी भणी शेष तेम छे. भाटे तेनु सर्वांगी अध्ययन लैन तेम ज लैनेतर तमाम शेषडोने अत्यंत लाभदायक छे.

सं. २००८, झागणु वड एकाहशी	}	भुनिराज श्रोतुष्वनविज्ञानतेवासी
मु. आलेगाम (जिल्हा: नासिक)		भुनि ज्ञानविज्ञय.

१. अहीं ‘दे बृशिन्’ पाठने अहो दे-मिन्’ पाठ ज साचो लागे छे.

# હીરસૌભાગ્યનું રેખાદર્શિન

લેખક-ગ્રા. હીરાલાલ ર. કાપડિયા એમ. એ.

જૈન સાહિત્ય એની વિવિધતા અને વિપુલતા માટે ચુવિષ્યાત છે. એમાં ડેવણ ધાર્મિક કૃતિઓ જ છે એમ નહિ; કાવ્યો, મહાકાવ્યોને અતુરૂપ સામયી પણ એમાં પિરસાયેલા છે. પ્રસ્તુતમાં હું “મહાકાવ્ય” તરફ એણાખાવાતા હીરસૌભાગ્યની આખી રૂપરેખા આપેયું છું.

નામ-પ્રતિષ્ઠાસેમે વિ. સં. ૧૫૨૪માં સોમસૌભાગ્ય<sup>૧</sup> નામનું કાવ્ય સંસ્કૃતમાં રચ્યું છે. એમાં એમણે ગ્રાબાવશાળી સોમસૌભાગ્યસુરિનું અવનવર્તાતોં<sup>૨</sup> રજૂ કર્યું છે. વળી તીજી સર્ગમાં પદ્ધતપરંપરા આપેલ છે. એમ લાગે છે કે આ રચના નોંધની હેતુવિમલગણિયે પોતાની કૃતિના નામના અંતમાં ‘સૌભાગ્ય’ શબ્દ ગોળું અને એમાં હીરવિજયસુરિનું ચરિત્ર ગૂઢ્યો એને ‘હીરસૌભાગ્ય’ નામ આપ્યું છે, અને ગુરુભરંપરા પણ આપી છે. આ એ કૃતિઓ સિવાયની ડોઈ જૈન કૃતિના અંતમાં ‘સૌભાગ્ય’ શબ્દ હોય તો તે જણનું બાકી રહે છે. વિ. સં. ૧૫૨૪ પહેલાંની ડોઈ અનૈન કૃતિના અંતમાં આવી રીતે ‘સૌભાગ્ય’ શબ્દ છે અશે?

સ્વોપ્રસ વૃત્તિથી વિભૂષિત આ કાવ્યને સ્વોપ્રસ વૃત્તિના પ્રારંભમાં તીજી પદ્ધતમાં ‘હીરસૌભાગ્યકાવ્ય’ એ નામે એણાખાવાયું છે. વળી પ્રત્યેક સર્ગના અંતની વૃત્તિની પ્રશ્નિતમાં પણ એમ જ ઉદ્દેશ્ય છે. વળી પ્રાય: પ્રત્યેક સર્ગના અંતિમ પદ્ધતમાં ‘હીરસૌભાગ્ય’ એવા ઉદ્દેશપૂર્વક આ કાવ્યનું નામ હીરસૌભાગ્ય દર્શાવાયું છે.

વિભાગ-હીરસૌભાગ્ય કાવ્યને સતત વિભાગોમાં વિભક્તા કરાયું છે અને દધુવંશાદ્ધિની રેઠ એ પ્રત્યેક વિભાગે ‘સર્ગ’ કહ્યો છે. સતત સર્ગોમાં અનુકૂળે નીચે પ્રમાણે શ્લોક સંખ્યાઓ:- ૧૩૮, ૧૪૨, ૧૩૫, ૧૪૮, ૨૧૧, ૧૬૫, ૬૫, ૧૭૧, ૧૫૬, ૧૩૧, ૧૫૮, ૧૩૦, ૨૨૭, ૩૦૬, ૮૨, ૧૪૨, અને ૨૧૪.

આમ ૨૭૮૮ પદ્ધતાના આ કાવ્યમાં એણાવત્તાં પદ્ધોવાળા સગોં છે, તેમાં ચૌહોનો સર્ગ સૌથી મોણો છે અને પદ્ધતે સૌથી નાનો છે.

પાઠંતર-છઢા સર્ગનું રજૂસું પદ ૨ પદમા પદ્ધતા પાડાંતર રૂપે રજૂ કરાયું છે.

તુટિ અને અશુદ્ધિ-ધ. સ. ૧૮ ઠમાં “નિર્ણયસાગર સુદ્રાશૂલય” તરફથી સ્વોપ્રસ વૃત્તિ સહિત છપાયેલા આ કાવ્યમાં ડોઈ ડોઈ સ્થળે પદ્ય કે પદ્ધાંશ ખૂલ્યે છે. ધ. ત. જીયો સર્ગ ૧૪નો શ્લો. ૧૬૪, સ. ૨. શ્લો. ૧૩૭ ને સર્ગ ૧૫નો શ્લો. ૩૨. વળી ડોઈ ડોઈ સ્થળો અશુદ્ધ છે. ઉદાહરણથી સ. ૬, શ્લો. ૬૪ની વૃત્તિ (પૃ. ૨૬૮)માં ‘ઓપાતિક’ ને અહીં ‘અપાતિક’ અપાયું છે. એની રીતે સ. ૧૪, શ્લો. ૮૭-૮૮માં ડેટલાક આગમોનાં નામ અશુદ્ધ છપાયાં છે. અહીં ડોઈ વિવિષ્ટ પ્રસ્તાવતા નથી ગોટું આ અધી બાબતો લક્ષ્યમાં લેતાં આ કાવ્ય વૃત્તિ સહિત ફરીથી છપાવવું ધરે.

૧. આ કાવ્ય ગુજરાતી ભાષાંતર સહિત છપાવાયું છે.

આ કાવ્યમાંથી આપણને અનેક ઐતિહાસિક સ્થળો અને વિજિતો વિષે માહિતી મળે છે.

૨. વાચક મેધનિન્યે વિ. સં. ૨૭૨૭માં શશુપ્રાકાશવધની પાદ્યપૂર્તિદ્વારે હેવાનંદ મહાકાવ્ય રચ્યો એમાં વિજયહેવસુરિ અને વિજયપ્રલસુરિના અવન વૃત્તાત્મ આપ્યો છે, એમણે રેખા માયામાં શ્રાદ્ધ કાવ્યમાં દ્વિજવિજય-મહાકાવ્યમાં પણ વિજયપ્રલસુરિનું અવનવર્તાત્મ છે. વળી મેધહૂત સામર્થ્ય દેખ નામનો પત્ર પણ વિજયપ્રલસુરિને ઉદ્દેશને છે.

અંક : ૭ ]

## હીરસૌભાગ્યનું રેખાદર્શન

[ ૧૩૩

આધા-મૂળ તેમજ રવેપણ વૃત્તિ એ બંનેની ભાષા સંસ્કૃત છે. એમાં ડેટલાક શબ્દોને સંસ્કૃતનો રવાંગ સંજાવાયો છે કેમકે મોગલ માટે મુહાગલ, મોગલોમાં મહાત્મ જણાવનાર યત્તન જાતિ નામ તરીકે 'ગાળ' (સ. ૧૪, શ્લો. ૮૨), જાતાખાન (સ. ૧૪, શ્લો. ૮૪) અર્થાત् મીઠાખાન, પાદશાહ માટે પાતિસાહિ (સ. ૧૪, શ્લો. ૮૪ની વૃત્તિ), મહામહ માટે મહમુન્હ (સ. ૧, શ્લો. ૧૨૬), શેખ માટે શેષ (સ. ૧૭, શ્લો. ૧૬૧), લ્યારી (એક જાતનું નાણું) એ બાટે લ્યારી અને લ્યારિકા (સ. ૧૭, શ્લો. ૧૭૧ ને ૧૭૨ અનુક્રમે), કથીપો એક જાતના વચ્ચે માટે કથીપક (સ. ૧૭ શ્લો. ૧૭૧), ઇરમાન માટે સ્કુરેનમાન (સ. ૧૧. શ્લો. ૧૮), પયગંઘર માટે પયંઘર (સ. ૧૩, શ્લો. ૧૩૭), કુરાન માટે કુરાન (સ. ૧૩ શ્લો. ૧૪૩) અને ઝુદ્ધ માટે ઝુદ્ધ (સ. ૧૩ શ્લો. ૧૩૪)

છંદ-આ કાથ્યમાં જાતજાતના છહેનો ઉપયોગ કરાયો છે. હા. ત. પ્રથમ સર્ગ મુખ્યત્વથી ઉપજાતિ છંદમાં અને છેલ્દાં વણું પદ્યો શાર્ડ્લવિક્રીડિતમાં છે. બાંને સર્ગ પ્રાયઃ વંશસ્થમાં, અનું ૧૩૪૮૦ પદ્ય મંહાકાન્તામાં, ૧૪ મું હરણીમાં અને ૧૪૧૮૦ તથા ૧૫૨૮૦ શાર્ડ્લમાં છે. ગોને સર્ગ મેટે લાગે વસંતિલકામાં અને અનું ૧૩૪૮૦ પદ્ય શાખરણીમાં છે. એરી રીતે અન્ય સર્ગોં વિષે ઉલ્લેખ થઈ શકે, આ તો રેખાદર્શન છે. એરલે હું અહીં વિરોધ અધિક હકીકિતો નોંધતો નથી.

**શૈલી**—શૈલી સુગમ અને રોચક છે. એમાં વધુ પહું પહું સમાચોટ નથી. રસપ્રવાહ એક-સરખો વહે છે.

**વિષય**—આ કાથ્યનો મુખ્ય વિષય 'જગદ્ગુરુ' ૧હીરવિજયસૂરિની જગનરેઆ-ધર્મ-પ્રવર્તન આવેખવાનો છે. પાર્થીનાથને, વાગ્દેવીને અને પોતાના ગુરુને પ્રથામ કરી તેમજ સંતોને પોતાને અનુકૂળ રહેવા વિનિ હેવવિમલગણિએ કાથ્યનો પ્રારંભ કરો છે. હીરવિજય-સૂરિના સંસારી-પક્ષે પિતા કુંરા અને ભાતા નાથીતું વર્ણન અપાયું છે. સ. ૩. શ્લો. ૨૧-૨૮માં ક્રમે સમયના અહે અને એ હવસનો ઉલ્લેખ છે. વૃત્તિમાં વિ. સં. ૧૫૮૮ નાં માસ તિથિ ધર્ત્યાહિનો જન્મ આશ્રોત્સ્વ નિર્દેશ છે. હીરવિજયસૂરિની ભાવ-કીડા, અને એમનો વિદ્યા-ભ્યાસ, એમની દીક્ષા, હેવગરિ (હેલતાભાદ)માં દિજ પાસે પહું, એમને અપાયેલી વાચક અને સૂરિની પહીની, એમણે કરેલું સૂરિમંત્રનું ધ્યાન, સપ્તાટ અદ્દાર સાથેનો એમનો પરિયય, એમના વિવિધ રથણોમાં વિદ્ધાર અને ચાતુર્મસીઓ, અફક્ષર દારા 'અમારિ' તું પ્રવર્તન, સૂરિની સુલેજના અને અંતિમ આરાધના, એમણે આદરેલું અનશન, એમતું વિ. સં. ૧૬૫૮માં નિર્વાણું, એમને અંગે રથાયેલી માંડવી એમના મૃત દેહનો ચંદનાહિ વડે અધિસંસ્કાર, અને સ્તૂપની રચના એમ મુખ્ય મુખ્ય બાબતો મનોહર પદ્યો દારા નિર્દ્યાર્થ છે.

આ પ્રમાણેના મુખ્ય વિષયની સાથે સાથે આનુષ્ઠાનિક વિષયો તરીકે ડેટલાક નગરોનાં વર્ણન છે. ચોથા સર્ગમાં મહાવીરસ્વામીની માડીને તેની વિજયદાનસૂરિ સુધીની પદ્યપરંપરા વર્ણવાદ્ય છે. વિનિવિધ જાતાનોના રૂષ્યોદ્ય, સર્યોસ્ત વરોરેનાં વર્ણનો છે. આહમા સર્ગમાં શાસનહેવતાનાં

૧ એમનો જન્મ વિ. સં. ૧૬૫૮માં અને સ્વર્ગવાસ પરમાં યથેલ છે.

૨ શિયુપાલ વધ (સ. ૧૧) માં 'માવિની' છંદમાં પ્રભાતાતું અન્ય વર્ણન છે.

१३४ ]

श्री नैन सत्य प्रकाश

[ वर्ष : १७

समर्पण अगोपिगोनुं तादश वर्णनं करायुं छे, हुमायु अने अकारनो परियथ हथमा सर्गभां करावायें छे. आखु, शत्रुंजय वर्गेरे गिरिशज्ज विषे विस्तारथी कथन करायुं छे.

चौहमा सर्गभां देव, युरु अने धर्म ए त्रषु तरवेनुं स्वदृप निइपायुं छे. वरेषभां एमां छ ब्रतेनी समजणु अपार्छ छे.

**रसमध सामधीः—**—सामान्य वाचकने रस उपलब्धनार वस्तु शी छे ते आनन्द-  
शंकर मुखे “ गुजरातनुं संस्कृत साहित्य ” ए नामना लेखभां तीये मुज्ज्य हस्ती छे:—

‘ हीरविज्ययुः अकार आदशाहनी सभामां भेषवेलुं मान, एमना उपदेशथी गुजरातभां जल्या वेरानी करवामां अवेली माझी, तथा एमनी सुसाफ्हीमां एमणे जेयेवां शहेरा — नहीयो — दुँगरेनां वर्णनो तथा ते ते स्थगेनां संस्कृत नाम वर्गेरे छे. आ नैन आचार्य उत्तरे दिल्ली अने कंठ्डार सुधी, दक्षिणे आनंदेश अने वराड सुधी अने काठिया-वाडमां हीव अने जिना सुधी इयी हता. गुजरातना वर्णनभां..... एमां ‘ आनन्दपुर ’ ‘ बृहनगर ’=वडनगर, तारंगानो हुंगर, आर्द्धी मांडीने वर्णन बाले छे एक स्थले ‘ बृंज-वाड ’ ना खुर्यहेवनी प्रतिमानो उद्देख आवे छे. साब्रमती अने एना कांडानी भूमिना हुंगरा, ढांगरना कचारडायो, अने एमां शेजातां पक्षीयो सारसे—गयो वर्गेरेनां अहु सुन्दर वर्णनो छे. गुर्जर देशतुं ‘ अहम्भवाभाव ’ ते मुख अने रहेहुं पाठ्य अने भावात ( ‘ स्तंभतीर्थ ’ ) ते कुंडल एम उपमा कड्ही छे. ‘ राजनगर ’ ( अमदवाद )थी अणुहव-पुर पाठ्य जतानी ‘ दुंजभूमि ’ विविध ७न्होनां नाम द्वारा वर्णनी छे.<sup>१</sup>

रसतानां आड उपर बिडां पोपटां टेलायो पणु कविना लक्ष अहार गया नथी. ‘ भिल्पत्ती ’मां किरतेनुं भद्र( काहम्भरी )पान भीवराज अर्जुनज्ञने करेलुं श्वरद्यातुं नियमदान वर्गेरेना वर्णन पछी आयु अने एनां हडेहां आवे ‘ छे.....’

“ ग्राचीन ‘ तक्षशिला ’ नेने आपणे पेशावर पासे हुं एम जाणीये धीये, तेने आपणा कवि ‘ भक्ता ’ धारे छे !—आ भाद करतां कविनां संस्कृत नामोनी योजना भराअर जप्त्यु छे.”

**सुभावयोव वृत्ति—**आ वृत्ति ( पृ. ६८१ ) मां नीये मुज्ज्यातुं स्कृत छे:—

“ कविता वनिता गीति: स्वयमेवागता वरम् ।

बलादाकृष्यमाणाऽपि सरसा विरसा भवेत् ॥ ”

गुजरातीभां कहुं तो—

कविता वनिता गीति, रुडी आवे स्वयं थह,  
ऐच्छी आणी वजे ज्ञे ए, सरसा विरसा थती.

१. उन्नतनगर ( उना ), आन ( आनदेश ), गोपावैद्वत ( गोपियर ) द्रोपपुर ( दीवभद्र ), पाद्मविष्पुर ( पाद्मताणु ), मेहिनीपुर ( मेडता ) विडमनगर ( बोधमेड ), श्रोरोहिणी ( रिरोही ).

२. “ कुत्रचिद् वाणिनी स्वविही शालिनी यत्र लोकवृणा कवापि वातोमका ।

हसमाला कवचित् कवापि कन्या मृगी कुत्रचिन्मालती पुष्पिताशा मुनः ॥

कवापि शार्दूलविकीडिते दशवते कवापि दद्यद् भुजङ्गप्रयातं मुनः ।

सुरिशीतवृत्ते: सर्पतः पद्धतौ छन्दसां जातिवत् कुत्रभूमिः स्म भूत् ॥ ”

અંક : ૭ ]

## હીરસૌભાગ્યનું રેખાઈર્ણ

[ ૧૩૫

આ વૃત્તિ કંઈ બહુ વિસ્તારવાળી નથી. અને એવી રચવાની તો વૃત્તિકાર હેવિમલા-ગાણુની છિંચા પણ નથી એ વાત નિષ્ઠનલિખિત પદમાં પ્રતિસાંપ્રે જોવાય છે :—

“ સ્વોપજ્ઞહીરસૌભાગ્યકાવ્યસ્યાવ્યાસશાલિનીમ् ।

કુર્વે વૃત્તિ વિદગ્ધાનાં જગત્યર્થવિવોધિકામ् ॥ ”

વૃત્તિની પ્રશાસ્તિ (શ્લો. ૨૦) માં સૂચવાયા મુજબ આ વૃત્તિનું નામ સુખાવાદોધા છે.

આ વૃત્તિમાં સમાસ અને છંદ વિષે નિરૂપણ નથી. ૧અલ્લાકાર વિષે કૃતચિત્ત ઉદ્દેશ્ય છે. મળ કૃતિનો અર્થ સમયમાં એવી રીતે શાખાર્થ અને ભાવાર્થ રજૂ કરાયા છે. શાખાર્થ અર્થ કરતી વેળા હૈન ડોશ વગેરેની સાક્ષી અપાર્થ છે. આ તેમજ ભાવાર્થ માટે રધુવંશા, નૈષધ્યચરિત વગેરેમાંથી અવતરણો અપાર્થાં છે. ડોર્ધ ડાઢ વાર બાકરણું વિષયક ચર્ચા પણ છે. કિયાકલાપનો પણ ઉપરોગ કરાયો.

સ. ૧૪, શ્લો. ૭૩માંના ચાચિલિ પ્રથોગ સિદ્ધ કરવા માટે પ્રક્રિયાકૈસુદીનો આશ્રય લેવાયો છે. ડોર્ધ ડાઢ કર્તાના સમયમાં પ્રયુક્તિ ગુજરાતી શબ્દો પણ નજરે પડે છે, જેમણે સમીરણ મારે સરવાય. સ. ૬, શ્લો. ૬૨), હિન્દુ (પૃ. ૬૧૮), કથીપો (પૃ. ૬૦૨), માંડવો (પૃ. ૬૦૨, ધાર્ટ (પૃ. ૬૦૨), ગંગેરિઓ ('ખંજન' પદી) (પૃ. ૨૧૮), અણાંયું (પૃ. ૧૭૫) ઇત્યાદિ, પૃ. ૬૮૧માં નીચે મુજબનું ગુજરાતીમાં અવતરણ છે :—

જરા યૌવનસ્યું પ્રાણું ન હોધ, જતાઈ પ્રાણું પ્રાણું ન હોધ.

પ્રાણુનાથસ્યું પ્રાણુન હોધ, કીતિં પ્રીતિસ્યું પ્રાણુન હોધ.”

**પ્રણીતા—હીરસૌભાગ્યના** કર્તાને પોતાના પરિચયિસે પ્રત્યેક સર્ગના અર્દતમ પદમાં થોડોક ઉદ્દેશ્ય કર્યો છે. એ દારા આપણે એ જાણી શકીએ છીએ કે શિવાસાધુ યાને શિવારેસાહુ એ એમના પિતાતું નામ છે, અને સૌભાગ્યહેવી એ એમની માતાતું નામ છે. હીરસૌભાગ્ય એ નામની કૃતિમાં એમણે એમની માતાતું નામ યોજી એને અમર બનાવી માતુભક્તિ હાખવી છે પ્રત્યેક સર્ગની વૃત્તિની પુષ્પિકામાં એમણે પોતાતું નામ હેવિમલગણિયું આપવા ઉપરાંત પોતાનો, પંડિત સીહિવિમલગણિના શિષ્ય તરીકે ઉદ્દેશ્ય કર્યો છે. વૃત્તિના અંતમાં આવીસ પદીની પ્રશાસ્તિ છે. એમાં કહ્યું છે કે ઉત્ત્રાપતિને આદ શિષ્યો હતા. તેઓ ઉત્તમ પંડિત હતા. તેમાંના એકનું નામ જગર્ણ હતું. એ વિશુદ્ધનો પરિચય આપતાં કહ્યું છે કે એએ છ વિકૃતિના ત્યાગી હતા અને ગૌતમસ્વામીની પેડ એએ છું છું વડે પારણું કરતા હતા. લુંપાડો વડે જેમનું સમ્બક્તવિદ્ય ધન લંટાયું હતું એ સૌરાષ્ટ્રના લોકાને એમણે પ્રતિભોધ પમાડું હતો. એમણે વાયક પાણીનું વાદમાં પરાસત કર્યો, તેથી એ વાયક ભાવહેન રામતું શરણું લઈ જેધપુરમાં ધણો સમય રહ્યો હતો. એમના આ જગર્ણના શિષ્ય તે વિશુદ્ધ સીહિવિમલ.

૧. સ. ૧૪ શ્લો; ૬૮માં અર્થનીતરન્યાસ 'અવકાસનું સૂચન છે;

૨. સાંદુનો અર્થ 'સાહ' કર્તા વેળા એમણે સુમતિસાહુસુદીત 'સૌભાગ્યકાંય'નો ઉદ્દેશ્ય કર્યો છે, જુઓ, પૃ. ૪૪

૩. એમના એક શિષ્ય નામે હર્ષિનાને વિવેકહર્ષગણિયું અને પ. પરમાંદ નામના એ શિષ્યો હતા, આ બનેને અકારસે સન્માનિત કર્યો હતા.

१३६ ]

श्री जैन सत्य प्रकाश

[ वर्ष : १७

ओमणे सभा समक्ष जेम वाही हेवसुरियो हिंगंबर कुमुहयन्दने परानित कर्या होता तेम गैतम नामना वाहीन्दने हरान्या होता ओमणे नारायण, दुर्गा वज्रे रामयोगे रप्रित कर्या होता, ओमणे मांडलिक जेवा यद्दबाण्य नामना इयस्थने पोतानो अक्ता शिष्य कर्या होता अने अन्नैन स्थानांसंहने जैन जनाव्यो होतो, ओमणे वृषभ जिनना समवस्यखनी रथना करानी होती, आ सीहिविमलना विनेय ते विषुध हेवविमल ओमणे सुखा ऐव्या नामनी वृत्ति रथी हीरसौभाग्यने निष्पुष्टित कर्युँ छे. कल्याणाविजय वाचकना शिष्य वैवनिजये आ समस्त काव्यनुं संशोधन कर्युँ छे. अंतमां जे कंटी सावद्य वयन होय ते निष्पुष्टिए सुधारी लेवुँ ओम आ प्रशस्तिमां कर्हुँ छे.

**रथना समय—**मूळ काव्यमां के ऐनी वृत्तिमां कर्ताये रथनासमयतो उद्देश कर्यो नथी, धर्मसागरगणियो गुरुपरिचारी जैद्धि भरहुमां पदमां रथी छे, अने ऐने संस्कृत वृत्तिशी विष्पुष्टित करी छे, आ सूक्ष्मिक वृत्ति पट्टावली समुच्चय ( आ. १, पृ. ४ -७७ ) “ श्रीतपागच्छपटावतीसूत्रम् ” अे नामथी छपावाई छे. वृत्तिना अंतमां पृ. ७७ मां आ कृति वि. सं. १६४८मां शोधायानो अने ए पूर्वे ऐना जे अनेक आदर्शी कराया होता ते ए ओमणे सुधारी लेवानो निर्देश छे. ए हिंदामे आ वृत्तिनी रथना नि. सं. १६४८ पटेवानी गण्याय. वृत्ति ( पृ. ७३, मां होरविजयसूत्रेना अरित्र आए हीरसौभाग्यकाव्य वज्रे लेवुँ ओम कर्हुँ छे. )

आ उपरथी आ काव्यनो मोटो भाग वि. सं. १६४८ पटेवां रथायो होतो ओम कडी शक्तिए. हीरविजयसूत्रियो हेडात्सर्ग नि. सं. १६४८मां थयो होतो. ऐने अगे हीरसौभाग्यमां वर्णुन छे. आथा ए इतित थाय छे के हीरविजयसूत्रिना ज्वनकाण स्फूर्त्यान शह अरापेहुँ हीरसौभाग्यकाव्य अमता निर्वाण बाह थेडाक वर्षतमां पूर्वु करायुँ होशे.

लै. सा. सं. ४. ( पृ. ४३ )मां धर्म गुरुपरिचारीनो तथा गच्छपटावली ए नामथी निहेश छे. जेतो रथना समय वि. सं. १६४६-४८ सुचवायो. छे. आ पृष्ठमां नीये ओमणे कर्हुँ छे—

“ हेवविमलकृत हीरसौभाग्य महाकाव्य, के जेनो उद्देश धर्मसागरीय पटावलीमां पणु कर्यो छे. तेथी तेनी पटेवां एट्टेसे सं. १६४६ पटेवां रथातुं आवतु होय ओम जणाय छे अने तेना पर स्वेपन ग्रीष्मा कर्ताये गिज्यहेवसूत्रिना राज्यमां३ ( सं. १६७१ के ते पछी ) पूरी करी ..ऋषभासे हीरसौभाग्य परथी गूजरातीमां मोटो ‘ हीरविजयसूत्रिनो रास ’ सं. १६४८मां भीजु हडीकेतो सहित अंबातमां रच्यो. ”

पटावली समुच्चय ( आ. १, पृ. १२०-१३७ )मां हीरसौभाग्यनी मुद्रित आद्यतिमांथी संपूर्ण चायो. सर्ग “ श्रीमन्महानीर पटपर॑ परा ” ना नामथी अपायो. छे. अने अगे संस्कृतमां आना संपादक दर्शनविजयल्लये टिपेण्या रथ्यां छे. पृ. १३७मां ओमणे टिपण्य द्वारा ओम कर्हुँ छे के वि. सं. १६३८मां शह करी, १६७१मां पं. हेवावस्त्रे स्वेपन हीरसौभाग्यकाव्य रच्युँ. आना आधार तरीके हीरसौभाग्यप्रशस्ति अवो उद्देश कर्यो छे. परंतु प्रशस्तिमां तो ए वात छे नहि तेतुं केम ? बाकी श्रीपति वज्रेने लगती जे आअतो अहीं अपाईछे ते तो छे. [ अध्यूर्ध ]

१. ओमणे वि. सं. १६४८मां धर्मपटेवली नामतुं आसाण शतक रच्युँ छे, ए छपायुँ छे.
२. डॉसंगत लभाणु लै. सा. सं. ४. मातुं छे.

## વैभारगिरि અને શ્રેણીક મહારાજા

લેખક : શ્રીયુત મોહનલાલ દીપચંદ ચોકરી

[ ૨ ]

(1) The new town of Rajagriha is said to have been built by king Srenika otherwise called Bimbisara the father of Ajatsatru, the contemporany of Buddha.

+ + + +

(2) On mount Baibhar there are five modern Jain temples, beside the ruins of an old Saiva temple.

\* \* \* \*

(3) The son Bhandar cave has one door and one window. This inscription, (in son Bhandar cave) which is not later than A. D. 200, and is perhaps earlier, records that a certain "Muni, named Vaira Deva, of powerful dignity, was able to obtain emancipation, having shut himself up for spiritual enjoyment in this auspicious cell" a retired abode of Arhantas, fitted for an ascetic for the attainment of liberation.

\* \* \* \*

(4) In the centre of the valley between the five hills and in the very midst of ten old city of Rajagriha, there is a ruined brick mound 19 feet 8 inches in height, .... A deminutive Jain temple, called Maniar math, stands on the top of the mound.

The second is a naked standing figure, with a seven headed snake forming a canopy over the head.

+ + + +

(5) Due north from Rajgir, and seven miles distant lies the the village of Baragaon, which is quite surrounded by ancient tanks and ruined mounds, and which possesses finer and more numerous specimens of sculptur than any other place.....

The ruins at Baragaon are so immense, that Dr. Buchanan was conveinced it must have been usual residence of the king; and he was informed by a Jain priest at Bihar that it was the residence of Raja Srenika and his ancestors.....I can show beyond all doubt that remains at Baragaon are the ruins of Nalanda.

१३८ ]

## श्री जैन सत्य प्रकाश

[ वर्ष : १७

गया अंडमा राजगिर अंगे थेहुँ नेया पडी, जे छूटाछवाया उल्लेख। संत्रहेवा छे ते तरह नजर फेरवीये। उपरनी अंगेल पाच नेवियामाँ जे के बहु महारवनी मार्गाही ज्ञेनधर्म संभव्यमां नथी, पछु ऐना परथी एटलुँ तो सहज पुरवार करी शक्य तेम छे के जैन अंगोमाँ, ए पठीना आगम अंथेयामाँ अने जैन साहित्यमाँ जे वातो क्लेवामाँ आपी छे एं कोई कल्पना के तरंग नथी पछु ऐतिहासिक भगवत् धरावती अनेकी हड्डीतो छे।

(१) 'राजगृह' तु नवु शहेर शेखिक उद्दे जिंभियारे अंधायुँ बहु अने समाट शेखिक ए अनातशकुना पिता छता।

(२) वैकार पर्वत पर पांच जैन भद्रिया छे अने नल्लमाँ शैव मंदिरनु अडियेर छे। आ ए नेवि लभाइ त्यारे जे रिथति प्रवर्तनी हुती ए एटलुँ तो। ज्ञाने छे के जैन अंथेयामाँ महाराज शेखिका सुस्त ज्ञेनधर्मी तरीके-भगवत् श्रीमहावीरना पाका अनुयायी तरीके-जे वर्णुना उपवस्थ थाय छे अने राजगृहमाँ—ऐनी नल्लना पहाडेमाँ-भास करी वैकारगिरि पर वारंवार प्रखु श्रीमहावीरना आगमन प्रसंगे तेमज दीधिली देशनायो आहिना वर्णुना ए अनेका अनावोना विवरणो छे। लगलग पर्यासो वर्ष पूर्वे ना ए प्रसंगेनी आधी-पातणी रम्भिर, गुहा डे लेख आहिना रब्बा-सवां चिह्नी ए वातनी साक्षी पूरता आजे पछु दृष्टिगोचर थाय छे।

(३) सोनलंडार याने सुवर्णुआंडार तरीके आवेदाता स्थानमाँ छ। स. २०० लगलगना लेखनी वात छे अने एमाँ सुनि वैरेव नामना शक्तिसंपन्न अने प्रतिभावन आत्माए अनशन करी, अरिहंतना स्थानमाँ रही सुकृत भेणव्यानी नोंध छे। ऐनो संभूष्य औद्धधर्म ज्ञेत नथी पछु जैनधर्म ज्ञेत हेवातुँ वधु संभवित छे, ए संभव्यमां आपछु साहित्यमाँ लीडा जीतरी अंडेडा भेणवानो प्रथास करवानी ज्ञर छे। एक्षुँ तो ज्ञाय छे के ज्ञेनधर्मी संतो आत्मानो साक्षात्कार करवा गुहायो जेवा एकांत स्थाननो उपयोग करता छता। गुहायो कृवगा औद्धधर्मना साधुओना वस्ती स्थानदृप हनी एतुँ एक्षुरीय मंत्र्य उचित नथी। वणी 'अनशन' संभव्यी वात ए ज्ञेनधर्म साथे ज्ञेतायेली छे।

(४) पांच टेकरीमोमाँ एक बाजु त्रयु अने भाऊ आजु ए आजे भोजुह छे। वयमाँ जे भीषु जेवो प्रदेश संभवे छे त्या पूर्वे जूतुँ राजगृह वसेलुँ हेलुँ जाम्ये। आर्डियेर तरीके जे ईटा-माटी विगरेनो ठगलो, लगलग वीस शीटो नजरे चहे छे ए पर एक जैन मंदिर छे अने ए 'भियुयारमठ' तरीके ओणाभाय छे। यीन अवशेषोमाँ जे भूर्तियो छे एमाँ एक नम भाबी भूर्ति माथे सात सर्पनी इणावणो छे।

ज्ञेनधर्मनो अभ्यासी उपरना वृत्तान्त परथी सहज जाणी शक्ति के सर्पैक्षुवाणी भूर्ति कां तो सातमा सुपार्श्वनाथ अथवा त्रेवीशमा श्रीपार्श्वनाथनी अने कायोत्सर्ग सुदामाँ होनी जोहओ। वणी 'भियुयारमठ' ना भूमाँ जैन साहित्यमानो नंद भियुयारे अने ए उपरनी वकुलिकाना वर्णनवाणो प्रसंग अंधेसतो हेअर्श शक्ति।

उपरना सामान्य उल्लेख परथी एटलुँ तो वगर शंकाये कही शक्य डे आजे राजगिर याने राजगृहना पांच पहाड पर जे हेरो गा छे ए लगलग त्रयु हजर वर्षे पूर्वे ना ए स्थानोमाँ ज्ञेनधर्मनो अलाव दर्शावनारा शैतिहासिक चिह्नो छे। लगवत् महावीर पूर्वे

અંક : ૭]

## વैભારગિરિ અને શ્રેણિક મહારાજા

[ ૧૩૬ ]

પણ રાજગૃહ-અગર જૂનું જે નામ હોય તે-નૈનધર્મતું એક મહાત્મતું ડેન્ડ હતું. વળી ત્યાં સારા પ્રમાણમાં નૈનધર્મી ઉપાસક હતા. નૈન મૂર્તિઓની સ્થાપના પૂજન કરતારા અનુયાયીની હાજરી વિના સંબંધિત નથી જ. વળી સાથીસાથ વીસમાં તીર્થીખતિ શ્રીમુનિસુવતસ્વામીની કલ્યાણક ભૂમિ તરફિ આ નગરીની નોંધ નૈન સાહિત્યમાં ઉપલબ્ધ થાય છે; તેમ જ પ્રતિવાસુદેવ જરસંધની આ રાજધાની હઠી એની નોંધ મળે છે તે પણ ઉપરના મંતવ્યને પુષ્ટિ આપે છે. આંગુલ શોધકોના વાંચવામાં બૌદ્ધ સાહિત્ય વિશેષ આવેલું હોવાથી, તેમજ ચીની મુસાફરોએ જે વર્ષનું અથે તૈયાર કરેલા, એ જ મેટા ભાગે વિદ્ધાનોની નજરે ચટેલા હોવાથી, અને નૈનધર્મ તેમજ બૌદ્ધધર્મ વચ્ચે ડેટલું ક સાંઘ હોવાથી, ડેટલીક એવી સખલનાંનો થઈ છે કે જેથી નૈનોને અન્યાય થયો છે. બૌદ્ધ અંશોમાં નેતૃનું નામ નિશાન પણ પ્રાપ્ત નથી થતું એવી આખતો શોધકોએ ઉપર રજુ કરેલ કારણોને લઈ બૌદ્ધના નામે ચદાવી દીધી છે!

આપણા નૈન વિદ્ધાનો, પોતાના અભ્યાસનો ઉપયોગ આ જાતની શોધખેણ પાછળ કરે અને શ્રીમંતે જેમાં દ્રવ્યનો પૂરતો સાથ આપે, તો નૈનધર્મની પ્રાચીનતા અને નૈન સાહિત્યમાં આવતા પ્રસંગે ને સ્થાનોની સત્યતા સહજ પુરવાર કરી શકાય અને જગતના નેત્રો સામે એક અતિમહાત્મના દર્શનની સાચી શાંતિ પાથરી શકે તેવા સિદ્ધાન્ત ધરાવતા ધર્મની-વિજ્ઞાનો દૃષ્ટિએ સો ટચના સુવર્ણ સમ તરી આવે એવા વિશ્વકલ્યાણકારી ઉપદેશની રજુઆત થાય.

ખાંચમી નોંધમાં રાજગૃહી નજીકના ‘બારગાવ’ અંગેની નોંધ છે. સાત માઈલ દૂરતું એ ‘બારગાવ’ કે ‘બારાગાવ’ અથવા તો કથાનકોમાં આવતું ‘ગોબર ગામ’ કે ‘કુંડલપુર’ એ જ એક વેળા અડાતાલીશ ગાઉના વિસ્તારવાળો—નૈન કથાનકોમાં આવતો રાજગૃહીનો ‘નાલાંદાપાડો’. નાલાંદાપાડો એટલે મુંબધની નજીકમાં જેમ અધીરી-વીદેપારદે અથવા તો માટુંગા જીવો ઉપનગરો છે તેવું એક ઉપનગર થાને પડું અલગતા, આ સ્થાન બીજુ ડેટલીક દૃષ્ટિએ સામાન્ય પરા કરતાં યદી જાય તેવું હતું. એ સંબંધી વધુ વિચાર આગળ પર રાખી નોંધમાં એ અંગે જે વર્ષનું છે તે જેણી લઈએ. શોધક ત્યાં ગયા ત્યારે આ સ્થાન જૂના તણાવો અને અંગ્રેઝોથી વાંટળાયેલું હતું, અને બીજી કોઈ પણ પણ સ્થળ કરતાં સુંદર અને વિષુવ સંખ્યામાં શિદ્ય કારીગરીના નમૂનામોથી ભરચક હતું, અથીત વિખરાયેલી સામાન્યોમાં ઉપરની ચીજેનું પ્રમાણ વિશેષ હોવાથી બીજીને આપે વળગતું. ‘બારગાવ’ ના વિશાળ અંગ્રેઝોને જેણી હોય, બુચાનન ( Buchanan ) ને ખાતી થઈ કે અહીં મહારાજનું નિવાસસ્થાન હોવું જેણે અને એના એ મંતવ્યમાં બિહારના એક નૈન સાંખ્યું સાથ પૂર્યો અને જલ્દીબું કે મહારાજા શ્રેણિક અને તેમના પૂર્વને આ સ્થાનમાં જ વસતા હતા.

એટલું તો નિઃશંક કહી શકાય કે ‘બારગાવ’ના અંગ્રેઝોને એ જ એક સમયનું સમૃદ્ધિ-શાળા ‘નાલાંદા’ હતું.

( ચાહું )

## પચીસ-કુસુમાંજલિ મહાકાવ્ય

બેખ્ક : પૂજય પં. શ્રીદુર્ગબરવિજયજી

શ્રીઅરિહંત પરમાત્માનો જન્મ થાય છે ત્યારે તેમનો જન્મભિષેક કરવા માટે સર્વે સુરેન્દ્રો સપરિવાર આવે છે ને પ્રભુને મેરુણિશર પર લઈ જાય છે ત્યાં પૂર્ણ અક્ષિથી અને અપૂર્વ ઉત્સાહથી જન્મભિષેક જરૂરે છે.

તેમાં શ્રીઠીર્થીંડરને પ્રથમ કુસુમાંજલિથી વધાવે છે. કુસુમાંજલિ એટલે ફૂલનો ભાગો. એ હાથનો ભાગો કરી તેમાં પુણ્ય લઈતે પ્રભુને વધાવવા તે કુસુમાંજલિ કરેવાય છે. સુરેન્દ્રનોના તે અક્ષિતકૃત્યના અનુકરણુંથે લબ્યાત્મકો પણ સ્નાત વગેરે કરે છે ત્યારે કુસુમાંજલિથી વધાવે છે અને તે રીતે કુસુમાંજલિનું વિધાન પ્રયત્નિત અને સુપરિચિત છે. વિશિષ્ટ વિધિ વિધાનોમાં વારંવાર કુસુમાંજલિ કરવાના વિધાનો આવે છે.

આ સર્વ પ્રસંગે જે કુસુમાંજલિ કરવામાં આવે છે તે મૂકપણે નાંદ પણ સુંદર અને ભાવવાળી સુકૃતોના ઉત્ત્યારણપૂર્વક કરવામાં આવે છે. તે અગેનાં વિશિષ્ટ પદ્ધો પણ તે પૂજય પુરણોના ગૂંઘેલાં પ્રાકૃત-સંકૃત-ગુજરાતી વગેરે લાખામાં પુષ્કળ છે. તે તે પદ્ધો વાંચવા માત્રથી પણ લાંબાલાસમાં વૃદ્ધ થાય છે અને આત્મામાં અનેક ભર્મિઓ જીછે છે. કુસુમાંજલિ અગેના ઉપલબ્ધ સાહિત્યમાં અને વિધાનમાં શિખર સમું વિરાજે છે ૨૫-કુસુમાંજલિનું વિધાન એટલે સાહિત્ય.

૨૫-કુસુમાંજલિનું વિધાન સાગોપાંગ અને વ્યવસ્થિત ‘આચાર-હિન્દુ’ અંથમાં છે. તે વિધાન અંજનતશલાકા-પ્રાણપ્રતિષ્ઠા પ્રસંગે, શાન્તિક-અર્હત-પૂજન, પૌષ્ટિક-અર્હત-પૂજન આદિમાં અવસ્થય કરણીય છે.

તેમાં પ્રથમ હાથમાં કુસુમાંજલિ લઈ ને પાંચ સુકો ઉદાર સ્વરે ઓલાને પણી તે કુસુમાંજલિથી જિનને વધાવવા. પણીથી પૂજનો શ્લોક અથુને વિહિત પૂજન કર્યો. શક્રતવ નમુન્યુણ ઉચ્ચરિને ધૂપપૂજનો શ્લોક ઓલાને ધૂપ ઉપેવવો.

આમ ૨૫ કુસુમાંજલિયો કરવાની હોય છે. તે દેરેકનાં પાંચ પાંચ સુકો એટલે ૧૨૫ સુકો કુસુમાંજલિનાં છે. ૨૫ સુકો જુદી જુદી પૂજનાં છે. ધૂપનો શ્લોક સર્વત્ર સમાન છે. એટલે સર્વ મળી ૧૫૩ શ્લોકપ્રમાણ આ કુસુમાંજલિ મહાકાવ્ય છે. તે તે પૂજને આધારે ૨૫ કુસુમાંજલિનાં નામ જુદી જુદી નાચે પ્રમાણે ઓળખવામાં ઉપયોગી થાય છે.

૧-ચન્દ્ર	કુસુમાંજલિ.	કુસુમાંજલિ
૨-કેસર	”	૧૪-વાસધૂપ
૩-યક્ષકર્મિ	”	૧૫-જલપૂજા
૪-કર્પૂર	”	૧૬-અસ્તારોપણ
૫-વાસ	”	૧૭-અંચાંગ રક્ષા
૬-મૃગમદ	”	૧૮-નિર્ણયનકરણ
૭-કાલાયુરે	”	૧૯-માલારોપણ
૮-પુષ્પાલંકારાવતારણ	”	૨૦-અપરાધક્ષામણ
૯-સ્નપનપીઠક્ષાલન	”	૨૧-દીપકપૂજા
૧૦-બિભ્રમાંજન	”	૨૨-દર્પણપૂજા
૧૧-બિભિરસિપુણ્યારોપણ,	”	૨૩-રતોત્પાદ

અંક : ૭ ]

## પચીસ-કુસુમાંજલિ મહાકાવ્ય

[ ૧૪૧

૧૨-ફલદોકન

કુસુમાંજલિ

૨૪-વિશાળિ

કુસુમાંજલિ

૧૩-અગુરુ

"

૨૫-ધ્યાન

"

હેડે કુસુમાંજલિ જુહા જુહા છન્દમાં અને યમકથ્થ છે. યમકથ્થ આવું કાબ્ય સંસ્કૃત સાહિત્યમાં આ એકજ છે એમ કહેવામાં લેશ પણ અતિશયોક્તિ નથી અને એ સત્ત્વ એ કાવ્યના વાચકને પોચ્યા માત્રથી પ્રતીત થાય છે. યમકાલાંકરને આ કાબ્યમાં જુહી જુહી રોતે એવા રમાઉવામાં આવ્યો છે કે તે અલંકાર એવા તો મરત બની ગેયો છે કે જાણે હવે તેને ભૌજાંકાઈની પરી નથી. જાણે એ કહેતો ન હૈથ કે જન્યાં સુધી આ કાબ્ય વિઘ્નમાન છે ત્યાં સુધી મારી હસ્તિને ડોઈ ટાળી શકે એમ નથી.

યમક એ શાસ્ત્રપ્રધાન અલંકાર છે. યમકનો અર્થ જોડલું થાય છે. યમકાલાંકરનું સ્વરૂપ 'આવ્યાતુશાસન'ના પાંચમાં અખ્યાતમાં આ પ્રમાણે છે:—

## 'સત્ત્વથેડન્યાયાનાં વર્ગાનાં દુઃતિક્રમૈકયે યમકમ्'

— જુહા અથેવાળા વણોના સરખા અવળું અને કબ સાર્થક હૈથ તે યમકઅલંકાર છે. તે યમક અલંકાર પાહને આશ્રયીને અને છે અને પાહના જાગેને આશ્રયીને પણ અને છે. પાહની આશ્રયિથી થતા યમકના ૧૧ જેઠ છે. તેનાં જુહા જુહા નામ આ પ્રમાણે છે:—

૧. સુખયમક-	૧-૨ પાદ સરખા હૈથ
૨. સંહશયમક-	૧-૩ " "
૩. આવૃત્તિયમક-	૧-૪ " "
૪. ગંભીરમક-	૨-૩ " "
૫. સંદર્ભક્યયમક-	૧-૪ " "
૬. પુણ્યમક-	૩-૪ પાદ સરખા હૈથ.
૭. પક્તિયમક-	૧-૨-૩-૪ "
૮. પરિવૃત્તિયમક-	૧-૪ "
૯. યુગ્મક્યયમક-	૧-૨-૩-૪ "
૧૦. સસુદ્રક્યયમક-	પ્રથમાર્ધ સમાન ઉત્તરાર્ધ હૈથ.
૧૧. મહાયમક-	*લોકની આવૃત્તિ હૈથ.

પાદ ભાગ યમકના ભેદો તો અગ્નિષુત થાય છે.

આ કુસુમાંજલિકાબ્યમાં ઉપરોક્ત યમકના ધળા ભેદો જેવા ભળે છે. શબ્દ ઉપર અદિતીય પ્રભુત્વ જાણું હોય ત્યારે ૭ આવો યમકથ્થ રચના થઈ શકે છે. આવા યમકો યોજવાથી અર્થકિલષ્ટતા થાય તે સ્વાભાવિક છે; છતાં આ કુસુમાંજલિકાબ્યમાં એવા સુન્દર અર્થભાવો ગુંથાયા છે કે જ્યારે તેનું અર્થોદ્વાટન થાય છે ત્યારે ચિત્ત નાચો બેઠે છે.

શબ્દ પ્રવાહ તો સુભધર નિર્દેશના જલસમે એકસરખે વહે છે. પૂર્ણનાં સુઝીતોમાં તો સુન્દર આવવાણી અર્થો ભાવો છે; જેમાં શાસ્ત્રાલંકાર કરતાં અથ્રાલંકરની સુખ્યતા જાળવી છે અને તેથી તે તે સુઝીતો એટલાં પ્રાસાદેક બન્યાં છે કે જુમન્ન માણુસ વાંચવા માત્રથી થાદ કરી લે એમ છે. તે કાવ્યના ઉટલાક નમૂનાઓ દર્શાવીને આ પરિચય પૂછું 'કરીશું':—

નાલીકં યન્મુખસ્યાયુપમિતિમલાન કાપિ વાર્તાન્તરાલે,  
નાલીકં યેન કિંચિત્ પ્રવચન દિતં શિષ્યપર્તસમક્ષમ.

१४२ ]

श्री. लैन सत्य प्रकाश

[ वर्ष : १७

नारीकं चापदाकत्या व्यरचयत् न वै यस्य सदोहमोहं,

नारीकं तस्य पादप्रणतिविरहितं नोऽस्तु तत्स्नात्रकाले ॥ ५ ॥

— कौष्ठि वातीप्रसंगे पशु जेमनां मुखनी समानताने कमजे आम नथी करी, जेमणे शिष्योनी पर्हेहा समक्ष प्रवयनमां असत्य क्षुं नथी, जेमना धनुपशक्तिथी बाणे राग-दैषने तथा क्षीं तेमना स्नानावसरे तेमना चरणनमनी रहित अमारुं लबाट न हो।'

आ प्रथम कुसुमांजलिनो पाचमो श्लोक छे. 'नालीक' शब्दहो तु सुन्दर श्लेष करने यमक्ते अज्ञात्युं छे, आप पशु कैठेका हृदयं गम छे ! आगण अहीं ज चन्दनपूजनो श्लोक रम्य अने लाववाडी छे.

'जेरी सपोना सतत वाँट्णारा उतां जेबे पेतानी शीतवतानो जरी पशु त्याग क्षीं नथी ते भवय अवतां मुकुटसमुं चन्दन अरिहंतनी पूजमां हो,' — ऐवा सुन्दर अर्थने समजावतो श्लोक आ छे—

फणिनिकरविवेष्टनेऽपि येनोऽन्तिमतिशैयमनारतं न किञ्चित्

मलयशिखरिशेवरायमानं, तदिदं चन्दनमर्हतोऽर्चनेऽस्तु ॥ ६ ॥

जगद्वन्द्वा मूर्तिः प्रहरणविकरैश्च रहिता,

विशालान्तां सुक्ति सपदि सुददाना विजयते ।

विशालान्तां सुक्ति सपदि सुददाना विजयते,

दधाना संसारच्छिदुरपरमानन्दकलिता ॥ २ ॥

आ त्रीश कुसुमांजलिनो श्लोक छे.

ओ प्रभाणे जेम जेम काव्य आगण वधुं जय छे. तेम तेम यमक्ती मन पशु वधती जय छे; ओ तो काव्य जेवाथी ने वाचवाथी जाणी शकाय.

चाथी कुसुमांजलिना प्रथम श्लोकमां—

आनन्दाय प्रभवभगवन्नङ्गसङ्गावसान !

ओ प्रभाणेना चारे पाह समान छे.

आ कुसुमांजलि काव्य उपर पुष्पांजलि करता श्रीवर्धमानसूर्य भद्रारण इहे छे के

"एवं पञ्चविंशतिकुसुमाङ्गलयः प्रक्षिप्यन्ते एतान्येव कुसुमाङ्गलिकाव्यान्तर्गतविधिकाव्य—  
पञ्चविंशतिरहितानि पञ्चविंशत्युत्तरशतसङ्घाग्नि स्तुतिकुसुमाङ्गलिमहाकाव्यं विद्विं-  
र्भगनीयं व्याख्येयं परिशीलनीयं पाठनीयं च ॥

आ प्रभाणे २४ कुसुमांजलिनोने प्रक्षेप करतो आ ज कुसुमांजलि काव्यमां रहेकां २४ विधिकाव्य सिनायना १-५ श्लोकप्रभाणु स्तुतिकुसुमांजलि भद्राकाव्यते विद्वानो अे लायनुं अने व्याख्याया विश्लेषित करतुं; वारंवार 'व्याख्या' अने लायावतुं. व्याख्या—श्रीका वार आ कुसुमांजलि-सूतोना अर्थी हुर्म छे, तेनी उपर व्याख्या उपवस्थ थी नथी. ऐट्ये व्याख्या रथवानो भ्यास आकु छे. ते व्याख्यासहित आ कुसुमांजलि भद्राकाव्य प्रकट थे. तेना अवद्यनपूर्वीक आ सङ्केतोनो २८ र<sup>२५</sup> आस्त्राहे अने अहौद-अकितथी अन्तःकरणुने रंगे ए ज.

## संपादकीय

‘श्री. नैन सत्य प्रकाश’ वर्ष १७, अंक ४-६मां श्री ज्योतिषभुजे लेखदेहो ‘पाठ्य-पुस्तकोंमां नैनोना परिचयिकांतीनी डेक्टी’ शीर्षक लेख प्रगट थयो हुतोः ए ग्रन्थ थेवा देखनी नडेहो प्रकाशक, संपादका तथा बीजे घटते स्थगे जनशुदारी गाँठ मोक्षनामां आपी हनीः अने पढी तेऽनेते तेमज लागतावलगता सज्जनोनेते आ कार्य मारे थेऽथ करवा अपील करवामां आपी हुती.

वर्त्मानपत्रांमध्ये पथ्य आपे प्रसिद्धि आपवानुं विचार्युं छे, ने आ आपेये लेख नैन’ सांतालिकना ता. ४-४-५.ना अंकमां प्रगट थयो छे अन्ते संपादकांमध्ये ‘सामयिक सुरुचि’मां अमारा विचाराने समर्थन करती एक नोंदध पथ्य प्रगट करी छे.

आ उपरांत मध्यभारत पुरातत्व विभागना आसिस्टेंट डेप्युटी डॉ. हरिहर निवेदी जेंग्या एम. जे. डी. लीट अने संस्कृतमां काण्यतीर्थनी उपाधि धरावे छे, तेयो अमारी साथेना पत्रब्यवहारमां एक लेख दिशे हिंदीभाष्ये जल्लावे छे, तेनो अनुवाद अहीं साहस्र अर्ही छिअः “श्री. ज्योतिषभुजो सेव पथ्य वाच्यो. आवा प्रयत्नोथी अंधकार दूर थारू शक्षे. आश्वर्य छे के, आज्ञे पथ्य उच्च जैन सिद्धांतोने मारे जनतानी अनास्था छे.”

आ अंगे स्थानिक डेणवणीकारो ने विद्वान भगवान्योने भणतां, तेऽनेके आ पाठ्ये सर्वथा अनिच्छन्तीय ने १०-११ वर्षाना बाणोना भगवन्मां नैनोनी अहिंसा विषे पूर्वाङ्ग इवावनारो छे, एम कही अमारी वातने समर्थन आप्युं छे.

एक व्योमधू कृष्णवणीकारे तो भूतकाणमां आ पुस्तक प्रगट थया पधी थेवा उष्णोग्नि विषे अन्ते मालिती आपी छे, जेने कालखो पुस्तकेने सहन कर्तुं पउलु-पथ्य ते भालिती हुल पूरता प्रभाष्यमां भणी न छावाथी हालमां ते प्रगट कर्तवी इच्छन्तीय गणुता नथी. संलग्नाय छे, के अंक नैन संस्थामां आ प्रहसन अववानी थेवी तैयारीओ छेल्लो धो अटकी गेवी.

आ लेखनी नडेहो अमे मुंथाई सरकारना डेणवणी जाता पर पथ्य मोक्षी हुतो छे, ने पाठ्य पुस्तक चिलेक्षण उमीदी तरह पथ्य स्वाना करी छे : जेतो कं॒धि ज्याय नथी.

अमारा पत्रब्यवहारना प्रथम परिलिख इपे प्रकाशक महाशय ( श्री हरिहर पुस्तकालय, दावररोड सरत ) तरहशी ज्यामां एक चोस्टकार्ड भल्युं छे, जे अमोजे आपेला ज्याय साथे नीचे रज्ञु करी छिअः

आपणी एक भासियत छे, के आपणे भूत अववानार तरह तदन संकुचित रीते वर्तीम्ब थिअः, ने अमे तेम कराने तेमने नीया पाउवा प्रथन करी छिअः, “ह'स-मध्यर” प्रकरण वथते पथ्य आवो अनुभव अमने थयो हुतो जे यथोंओ निभालस, तंदुरस्त ने शक्षिणिक दृष्टिअंदुथी थनी हाय तेमां आवो व्यवहार अनुचित छे.

एक वात नोधीरी रही जाय छे, के जेनो तरहशी एकहम उदार ने निभालस ज्यायनी आशा हुनी तेवा संपादक भगवान्यो [ थी लेख मल्यानी, पत्र भगवान्यो पछांच सुक्ष्मा पथ्य नथी. ]

—संपादक

१४४ ]

श्री. लैन सत्य प्रकाश

[ वर्ष : १७

'साहित्य पाठावलि' पुस्तकना अकाशकोने उत्तर

श्री. बीमनवाल शाह

हरिहर पुस्तकालय, टावर रोड,

तंची : श्री लैन सत्य प्रकाश, अमहावाद

सुरत, ता. २-४-५२

लाई श.

आपनो अक ता. १५-३-५२नो ५-६ मल्लो. ज्वालामां लग्नानु के अनारी भव्या डाई पण धर्मना माणसनी लागऱ्यी कडापि न हुआय झेंगी छे, छतां लाई था ज्यकिञ्चित्पुनी अस्तानाता पर हया आवे छे कारण, साहित्य पाठावली ला. १-२-३ घेन्यु ५-६ अने ७ माटे छे ज्यारे तेमणे धारणु ३ माटे लभ्यु' छे.

जीजु' आ पुस्तक छेदना १५ वर्ष थायो प्रगट थाय छे. ज्यारे तेओ लग्ने ले के तान्त्रिकरमा प्रगट थयु' छे वाच्या प्रथम आवृत्तिनु निवेदन, जे नवी आवृत्तिमा पछु तारीख साथे भूक्यु' छे.

१६३७ थी १६४८ सुधी आ नें आग तेना चिनो साथे सुंअर्ह इर्बुट्टक प्रेसे अदार पाउचा हता, ज्यारे १६४८थी अमो छापीये छाये.

आपनी आ अंगेनी सूचना भाटे लेखकोने भणी धर्तुं करशु'. अने ज ता. क. : वनराज चावडा'नी संक्षिप्त आवृत्ति आणडा माटेनी मारा ज्यालमां छे त्यां सुधी सर्वु साहित्य वर्धक कार्यालये छापी छे आई श्री. ज्यकिञ्चित्पुने डेम ते नजरमां न आवी, ते समझतुं नथी !

४४८

संपादक तरसेथी अकाशकने आपायेदो ज्वाल

श्री लैनधर्म सह्यप्रकाशक समिति  
ज्येशंगभाईनी वाडी, वीकांटा,  
अमहावाद, ता. ५-४-५२

१. २. रा. लाईशी,

संचालक, हरिहर पुस्तकालय : सरत.

आपनो ता. २-४-५२ नो पत्र मल्लो. आपे लभ्यु के, अमारी छूट्या डाई पण धर्मना माणसनी लागऱ्यी कडापि न हुआय तेवी हे: तो आ वाच्यी अमे युक्ता थया छाये. आ पाठी लैनेनी लागऱ्यी हुआय तेम छे, तो अस्त्रय धर्तुं करशी.

आपे श्री. ज्यकिञ्चित्पुने भाटे रेखपूर्वक ऐ न छाजता शब्दो वापर्या, ते हीक नथी. तेमना लक्षमां आयु' ने तेमणे ज्यावयु'. एक भूल ज्यारे आयी त्यारे ए सुधारी लेनी धरे. भूल अतावनार तरइ रेख पकट करवामां औचित्य नथी. धोरणु ३ अनी भूल सुदृश्योप छे, ते लक्षमां लेशी.

आपे लेखकोने भणीते धर्तुं करवानु ज्यावयु' पछु मने लागे छे के, आप ज्याता ज दशो डे, आ पाठना लेखक श्री. महीपतराम छे ने तेओ धयां वर्षो पहेलां गूळरी गया छे. पछु हु' न भूवतो डेउ तो आपनो आशय लेखक एटवे डे संपादका विषे ज हशे.

प्रस्तुत पुस्तकना अने संपादका उत्कुर्हल छे. आशा छे के, तेओ आपना भत्तो भणता थयो ने धर्तुं करशे ज.

અમે પણ તેમને એક પત્ર વિનંતિસ્પે લખીએ છીએ.

આપે જે બીજુ વિગતો પૂર્ણ પાડી તે બહલ આલાર. એ અંગે અમે ધટ્ટનું કરીશું.

કૃપા કરીને સંપાદકોને મળ્યા પછીનો આપનો નિર્ણય જણુંવી આલારી કરશો.

લિ. આપનો

અંભાલાલ પ્રેમચંદ શાહ

વ્યવસ્થાપક

સંપાદક મહાશયોને લખાયેલો એક વધુ પત્ર

અમદાવાદ તા. ૫-૪-૫૨

રા. રા. ભાઈશ્રી,

સંપાદક : સાહિત્ય પાઠાનલી.

વિ. વિ. સાથે જણાવવાનું કે આ સાથે શ્રી. હરિહર પુસ્તકાલયના સંચાલક ભાઈશ્રીના પત્રની નકલ ભીતીએ છીએ. સાથે આપની જણું માટે અમારા જવાબની નકલ પણ ભીતીએ છીએ.

અમે નમ્ર રીતે આપના લક્ષ્યમાં લાવવા માગીએ છીએ કે, પ્રકાશક મહાશય પોતે ધટ્ટનું કરવા તૈયાર છે; ને હવે તેનો આધાર આપના પર છે.

તો આશા છે કે, આપ પણ ઉદ્ઘાર વચ્છુ દાખવી, જૈનોને જરૂર ન્યાય આપશો.

આપના જવાબની રાહ જોઈ એ છીએ.

લિ. આપનો

અંભાલાલ પ્રેમચંદ શાહ

વ્યવસ્થાપક

ACHARYA SHRI KAILASSAGARSURI GYANMANDIR  
SHREE MAHAVIR JAIN ARADHANA KENDRA  
Koba, Gandhinagar - 382 007.  
PHONE : (079) 23276252, 23275204-05  
FAX : (079) 23276249



## પ્રાચ્યોન સંતવાણી



દીધાં કહિનાં નવિ હુઈં, સુકુમ હુકુમ સંસારિ;

કરમિદી રામતિ રોલવિડ, સુના વનહ મજારિ.

દાનહ વેલાં ડેજલાં, વિરલુ કો જગ્યા હોએં;

જલહર જલ હેવા સમર્થ, જમુહર હુઈ સોએં.

સુકુમ હુકુમ દીધાં હુઈ, તોઓં મૂઠ મ ચિંતિ;

જઈ કુદવ વાવાં હુઈ, તોમ સાલિ ઝલાંતિ.

Shri Jaina Satya Prakasha. Regd. No. B. 3801 श्री जैन सत्य प्रकाश

दरेके वसाववा योग्य

## श्री जैन सत्य प्रकाशना विशेषांके

(१) श्री महावीर निर्वाण विशेषांक

अमृतान महावारस्वामीना ज्वन संभंधी अनेक लेखाथी  
समृद्ध अंक : मूल्य ७ आना ( टपावभर्यनो एक आना १५ ).

(२) कमांक १०० : विक्रम-विशेषांक

सआड विक्रमादित्य संभंधी ऐतिहासिक लिङ्गबिक्ष लेखाथी  
समृद्ध २४० पानानो दण्डार सचिन अंक : मूल्य हाँ इपिया.

श्री जैन सत्य प्रकाशना ऐ विशिष्ट अंके।

[१] कमांक ४३-जैनधर्मनमां मासाङ्गार डोवाना आक्षेपेना  
ज्वाब आपता लेखाथी समृद्ध अंक : मूल्य चार आना.

[२] कमांक ४५-५. स. श्री डेमयंद्रायार्य म०ना ज्वन संभंधी  
अनेक लेखाथी समृद्ध अंक : मूल्य त्रिशु आना

काची तथा पाकी फाई लेला।

‘श्री जैन सत्य प्रकाश’नी त्रीज, पांचमा, आठमा, दशमा, अमियारमा,  
बारमा, तेरमा, चौहमा तथा पंद्रमा वर्षनी पाकी फाईली तेयार छे.

मूल्य दरेकना अटी इपिया

— लेखा —

श्री जैनधर्म सत्यप्रकाशक समिति  
जेशिंगमार्थनी वाडी, धीकांदा, अमदावाद.

श्री जैन सत्य प्रकाशनुँ वार्षिक लवाजम त्रिशु इपिया

मुद्रक : गोविंदलाल जगेशभाई शाह, श्री उमरुद्दी मुद्रण्यालय, पानडार नाडा, अमदावाद.

प्रकाशक : वीमनलाल गोडगांव शाह

जैनधर्म सत्य प्रकाशक समिति कार्यालय, जेशिंगमार्थनी वाडी, धीकांदा रोड-अमदावाद.